

SURAT MUNICIPAL CORPORATION

SECRETARY BRANCH



R. T. I. ACT - 2005

PROACTIVE DISCLOSURE UNDER RTI ACT

YEAR – 2024

AS ON DATE 31-03-2024

Office : -

**Secretary Branch,
4th Floor, New Annexy Building,
Surat Municipal Corporation,
Muglisara, Surat-395003.
Phone No. (0261) 2423750 to 2423756 &
2422285 to 2422287
Ext. No.424.**

**Public Information Officer
&
I/c.Assistant Secretary,
Secretary Office,
Surat Municipal Corporation**

SURAT MUNICIPAL CORPORATION
SECRETARY BRANCH

Index

Sr. No.	Content	Page No.
1.	Preface	1-2
2.	Proactive Disclosures :English Version	3-7
3.	પ્રો-એક્ટીવ ડીસ્ક્લોઝર : ગુજરાતી અનુવાદ	8-27

SURAT MUNICIPAL CORPORATION

SECRETARY BRANCH

- **Objective**

Secretary Branch is Corporation's allocated branch which is governed by the rules and regulation prescribed under the GPMC Act -1949.

The Secretary Branch shall put up the proposal received from Municipal Commissioner or any Councillor before the concern committees.

- **Prime Duties of Secretary Branch**

The Secretary Branch shall perform such duties as is directed by or under the GPMC Act with regard to the Corporation and the Standing Committee as shall be required by those bodies respectively. The Secretary Branch has the custody of Municipal Seal. As per the provisions of the GPMC Act, 1949, the Municipal Seal must be affixed on each & every contract executed between the party & Municipal Corporation in the witness of two councillors of existing Standing Committee. All papers and documents connected with proceedings of General Board, Standing committee and other committees are maintained by Secretary Branch.

- **Further Relevant Duties**

The Branch shall have to deliver the Agenda of business to each of Councillors to their last known address. Each notice of the meeting shall be given specifying the date, time and place where the business mentioned in the same shall be carried out, by the Secretary Branch. There is a special provision for the notice of the meeting of General Board that the same shall be published in a daily news paper having substantial circular and, as far as practicable.

- **Keeping of Minutes and submission of Report**

- The keeping of minute of the meeting is aim work for the Secretary Branch. A minute shall be kept by the Municipal Secretary of the names of the members present and of the proceeding at each meeting of the General Board and each various committee's meeting in a book to be provided for Minutes book of the all Special committees, the General Board and Standing committee shall at all reasonable time be open at the Municipal Secretary's office.
- The Secretary Branch has to follow the smooth function of every meeting of General Board, Standing Committee and other Special Committees.
- Under the Provisions of Bombay Provincial Municipal Corporations Act , 1949, Section - 4, the powers have been vested in three Distinct Statutory Authorities :

- **Branch Structure**

- The present Secretary Department has the Municipal Secretary as its Head of Department. Municipal Secretary is appointed under section 45 (1) of Bombay Provincial Municipal Corporation Act- 1949.
- The Asstt. Secretary, Section officer, Personnel Assistant shall work under the Control and supervision of Muni. Secretary and follow the instruction. They take the authority charge for follow the smooth function and procedure of General Board, standing committee and various Committees' meeting and obey the instruction, given by Municipal Secretary to all clerical staff.
- A 1st Grade and 2nd Grade Clerk shall appointed as proceeding writers, noting the Whole Procedure and prepare authentic records & maintain the records for all the special Committees.
- All the necessary orders of the Muni. Secretary must be followed by all his subordinate staff.

- **Authority**

- The Secretary Branch shall be under the control and supervision of the Standing Committee.

- **Functions**

- **Receipt of Proposal** The aim work of Secretary Branch is to receive the proposal from Various Department through the proper Channel like Municipal Commissioner, Chief Auditor or any councilor of the body etc.
- **Prepare the Agenda** All the proposals should be put on the agenda of concerned Committees as per it received Sequence for last inward number.
- **Resolution** In the meeting of all Committees, they must follow the agenda for their work discussion and give the opinion/decision to pass the resolution for particular work of the same.
- **Resolution number sequence** The Secretary Branch should follow the Sequence carry forward resolution number of last committee meeting's allotted to previous work agenda, the number start at every succeeding year to carry forward for last day of the same year.
- **Dispatch the Relevant File to their Concerned with Resolution** After resolution procedure the department should forward the relevant proposal file with resolution to the Municipal Commissioner, Chief Auditor or the relevant channel from where it received for the approval.

SURAT MUNICIPAL CORPORATION

SECRETARY BRANCH

PROACTIVE DISCLOSURE UNDER RTI ACT

I.	Organization , Function & Duties	<p>✓ The organization of Surat Municipal Corporation consists of three authorities :</p> <ul style="list-style-type: none">• Surat Municipal Corporation (General Board)• Standing Committee• Municipal Commissioner <p>✓ Standing Committee comes into existence as per the provisions of Sec.20 & 21 of the GPMC Act and the Rules and Regulations for conducting the meeting of General Board as well as Standing Committee are under the provisions of the GPMC Act,1949 are as mentioned in the book of the Rules & Regulations to conducting the meetings of General Board & Standing Committee Rules 1980. Annexure-1 & Annexure -1.1.</p> <p>List of Surat Municipal Councilors http://www.suratmunicipal.gov.in/Corporation/Corp_list</p> <p>List of Committees http://www.suratmunicipal.gov.in/Corporation/Committees</p> <p>✓ Mayor shall be elected in the First General Board Meeting of SMC under the provision of Sec.19 (1) of GPMC Act, 1949, amongst the councilors elected in General Election as a Chairman of General Board. Simultaneously, 12 members of the Standing Committee shall be selected in the said meeting u/s.20 of the GPMC Act, 1949. Chairman of Standing Committee, shall be elected in the First Meeting of Standing Committee under the provision of Sec.21 (1) of GPMC Act, 1949, amongst the 12 councilors selected as the members of the Standing Committee. General Board, Standing Committee & Special/Adhoc Committees are the authorities to decide the proposals forwarded by the Municipal Commissioner. Municipal Secretary is the Administrative authority with regard to the administration of the Secretary Office.</p>
----	----------------------------------	---

		<ul style="list-style-type: none"> ✓ Special Committees & Adhoc Committees of the Surat Municipal Corporation comes into existence under the provisions of Sec.30 of the GPMC Act, 1949 and the Rules of conducting the meeting of Special Committees are conferred by sub section 1 of section 457 of the GPMC 1949, under Section 457 (2) of the GPMC Act 1949, which are mentioned in the book of Rules & Regulations of conducting the meeting of various Special Committees, 1989. Annexure-2 & Annexure -2.1. List of Committees http://www.suratmunicipal.gov.in/Corporation/Committees ✓ Powers & Functions and duties of Special Committees are framed under the various sections of the GPMC Act, 1949 which are sanctioned by various resolutions of General Board of Surat Municipal Corporation and which are mentioned in the book known as the Function & Administration Rules of The Special committees 1989. Annexure-3, Annexure -3.1, Annexure -3.2 & Annexure -3.3.
II.	<p>The Powers and duties of its officers and employees</p> <p style="text-align: center;">-Conti..-</p>	<ul style="list-style-type: none"> ✓ Municipal Secretary is a Secretary of the Corporation as well as of the Standing Committee; Duties & powers of Municipal Secretary are as described under Section 48 of the GPMC Act.1949. Annexure - 4. ✓ Duties of the Section Officer are to supervise the General Establishment Administration. He shall have to control over all the staff of Secretary Office. He shall be directly responsible to his immediate reporting authority i.e. Municipal Secretary. He shall have to manage the day-to-day functions with regard to general administration & staff management etc. ✓ The Asstt. Secretary shall have to supervise over all the proceedings in respect of the General Board, Standing Committee, Special Committees & Adhoc Committees, such as, to publish agenda, conduct the meeting, drafting of resolutions as per the decisions taken in the meetings, to assist the Chairman/Chairperson of the Special Committees by the concerned proceeding writers etc. Personal Assistant shall have to discharge the duties as per the order of the Municipal Secretary from time to time. Normally, they will be put directly under the Office Bearers and responsible for the duties assigned to them either by the Office Bearers or by Municipal Secretary. ✓ Section Officer & Asstt. Secretary shall be responsible for the follow up of the smooth function and procedures of General Board, Standing committee and various Committees' meeting.
III.	<p>The Procedure followed in the decision making process, including channels of supervision and accountability.</p>	<p>The procedure followed in the decision making process starts on the first meeting of the General Board of Surat Municipal Corporation held on the date & time fixed by the Municipal Commissioner after declaration of the results of General Election. The election of Mayor, Dy.Mayor and twelve members of the Standing Committee takes place in the said first meeting. Thereafter, in due course, the members of Special Committees and Adhoc Committees are elected in the General Board meeting. Commissioner forwards the proposals for the consideration and necessary sanction of General Board, Standing Committee and Special/Adhoc</p>

		Committees as per the rules and regulations framed under the provisions of the GPMC Act, 1949 from time to time. Agenda of such proposals are prepared & published and finally as per the decision taken by the said authorities, resolutions are drafted to that effect. The Muni.Secretary as an authority to confirm the resolutions signs the draft and send it back to the Commissioner for implementation thereof. In general administration as well as Establishment of the Secretary Office, Municipal Secretary is the sole authority under the Standing Committee.
IV.	The norms set by it for the discharge of its functions.	The norms are set by the various provisions of the GPMC Act, 1949 for discharging the duties for its functions.
V.	The rules, regulations, instructions, manuals and records held by it or under its control or used by its employees for discharging its functions	The rules, regulations, instructions, manuals and records held by it or under its control or used by its employees for discharging its functions.
VI.	A Statement of the Categories of Documents That are held by it or under its control.	<i>Pakka</i> hand written minutes book containing the proceedings of the General Board, Standing Committee, Special Committees & Adhoc committees are maintained by Secretary Office. Normally, last two years minutes books are kept in the custody of Municipal Secretary. Minutes books of preceding years are sent to the Record Branch of SMC to maintain as a permanent record. Office copy of the resolutions of Board & Committees along with original proposal & the attachments thereto in respect of the proposal are kept in the custody of the Secretary Office. In the administration, the service books of the employees as well as office orders, notes, circulars are maintained by Secretary Office. Annexure – 5.
VII.	The particulars of any arrangement that exists for consultation with, or representation by, the members of the public in relation to the formulation of its policy or implementation thereof	Not applicable.
VIII.	A Statement of the boards, councils, committees and other bodies consisting of two or more persons constituted as its part or for the purpose of its advice, and as to whether meetings of those boards, Councils, Committees and other bodies are open to the public or the minutes of such meetings are accessible for public.	The General Board meets once in a month and the public can witness the proceedings through the public gallery with the written consent of Municipal Councilors & Municipal Secretary .Standing Committee and special/adhoc committees meet at regular intervals of time and it is not open to public participation. All the proceedings of these committees are public documents and are available to the public on the payment of prescribed fees at SMC.
IX.	A directory of its officers and employees.	Availabe on Below Page No.26 to 28.

X.	The monthly remuneration received by each of its officers and employees, including the system of compensation as provided in its regulations.	Availabe on Below Page No.29 to 31.
XI.	The budget allocated to each of its agency, indicating the particulars of all plans, proposed expenditures and reports on disbursements made.	The budget allocated to Secretary office, indicating the particulars of proposed expenditures and disbursements. http://www.suratmunicipal.gov.in
XII.	The Manner of Execution of subsidy programmes, including the amounts allocated and the details of beneficiaries of such programmes.	Not applicable.
XIII.	Particulars of recipients of concessions, permits or authorizations grants by it.	Not applicable.
XIV.	Details In Respect of The Information, Available to or held by it, reduced in an electronic form.	<p>Agenda & resolutions of General Board, Standing Committee, Special/Adhoc Committees, Administrative Staff Structure, Duties & Functions of Municipal Secretary, Rules and Regulations of Conducting the meeting of General Board & Standing Committee, Special Committees, Powers and functions of Special Committees, Budget summary.</p> <ul style="list-style-type: none"> • List of Surat Municipal Councilors :- http://www.suratmunicipal.gov.in/Corporation/Corp_list • List of Committees :- http://www.suratmunicipal.gov.in/Corporation/Committees • Rules in respect of the proceedings of the Corporation and Standing committee :- Annexure-1 & Annexure -1.1. • Rules & Regulations of conducting the meeting of various Special Committees, 1980 :- Annexure-2 & Annexure -2.1. • Function & Administration Rules of The Special committees 1980 :- Annexure-3, Annexure-3.1, Annexure-3.2 & Annexure -3.3. • General Board, Standing Committee, Special/Adhoc Committee's Agenda :- http://www.suratmunicipal.gov.in/Information/AgendaHome

		<ul style="list-style-type: none"> General Board, Standing Committee, Special/Adhoc Committee's Resolution :- http://www.suratmunicipal.gov.in/Information/ResolutionHome
XV.	The particulars of facilities available to citizens for obtaining information, including the working hours of a library or reading room, if maintained for public use.	<p>There is no separate library or reading room in this department for public use. But for obtaining information, application made under the rules of Right To Information (RTI) Act, there is official timing of scrutiny examination is between 10-30 a.m. to 02-30 p.m. and 03-00 p.m. to 06-10 p.m. during regular working days.</p> <p>Address : Secretary Branch 4th Floor, New Annexi Building, Surat Municipal Corporation, Mugalisara, Surat-395003.</p>
XVI.	The Names, Designations and other particulars of the public information officers.	Most probably matters are jointly upload on https://www.suratmunicipal.gov.in/Information/RTI/RTI_PIO_APIOs except changes occurred in short period of time and it updates on regular time period.
XVII.	Such other Information as may be prescribed and thereafter update these publications every year.	<p>RTI Application :-</p> <p>(1) Dt.01-04-2023 to Dt.31-03-2024 Register -1</p> <p>RTI Appeal :-</p> <p>(1) Dt.01-04-2023 to Dt.31-03-2024 Register -2</p>



સુરત મહાનગરપાલિકા સેક્રેટરી ઓફિસ



આર.ટી.આઈ.એક્ટ-૨૦૦૫
પ્રો-એક્ટીવ ડીસ્ક્લોઝર (પી.એ.ડી)
સને - ૨૦૨૪
(તા.૩૧-૦૩-૨૦૨૪ ની સ્થિતિએ)

ઓફિસ:- ચોથો માળ, નવી એનેક્ષી બિલ્ડીંગ,
સુરત મહાનગરપાલિકા,
મુગલીસરા, સુરત-૩૯૫૦૦૩.
ફોન નં. (૦૨૬૧) ૨૪૨૩૭૫૦ થી ૨૪૨૩૭૫૬ અને
૨૪૨૨૨૮૫ થી ૨૪૨૨૨૮૭
એક્સ્ટે. નં.૪૨૪.

જાહેર માહિતી અધિકારી
અને
ઈ.યા.આસીસ્ટન્ટ સેક્રેટરી,
સેક્રેટરી ઓફિસ,
સુરત મહાનગરપાલિકા.

મુદ્દા નં.૪(૧) (ખ) (૧) : સેક્રેટરી શાખાનું વ્યવસ્થા તંત્ર, કાર્યો અને ફરજોની વિગત:—

- સુરત મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ત્રણ સત્તાઓ અસ્તિત્વ ધરાવે છે:
- સુરત મહાનગરપાલિકા(સામાન્ય સભા)
- સ્થાયી સમિતિ અને...
- મ્યુનિસિપલ કમિશનર.

ઘી જી.પી.એમ.સી. એક્ટની કલમ-૨૦ અને ૨૧ ની જોગવાઈઓને આધિન સ્થાયી સમિતિ અસ્તિત્વમાં આવે છે અને સામાન્ય સભા અને સ્થાયી સમિતિની સભા યોજવા/બોલાવવા માટેના નિયમો/વિનિયમો ઘી જી.પી.એમ.સી. એક્ટ,૧૯૪૯ ની જોગવાઈઓને આધિન "સામાન્ય સભા (સુરત મહાનગરપાલિકા) અને સ્થાયી સમિતિની સભાઓની કાર્યવાહી અંગેના નિયમો-૧૯૮૦" ની પુસ્તિકામાં દર્શાવેલ છે. ([એનેક્ષર-૧](#) અને [એનેક્ષર-૧.૧](#))

આમ, સેક્રેટરી વિભાગ મુખ્યત્વે સામાન્ય સભા, સ્થાયી સમિતિ, જુદી જુદી ખાસ સમિતિઓ અને તદ્દર્થ સમિતિના સંચાલનની કાર્યવાહી વિગેરેને લગતી ફરજો અદા કરતો કમિશનર કચેરી કરતા અલાયદા વિભાગ તરીકે ફરજ બજાવે છે.

- સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પછી ચૂંટાયેલા કાઉન્સિલર્સમાંથી જનરલ બોર્ડ (સુરત મહાનગરપાલિકા) ના અધ્યક્ષ તરીકે ઘી જી.પી.એમ.સી. એક્ટ, ૧૯૪૯ ની કલમ-૧૯ ની પેટા કલમ(૧) ની જોગવાઈ હેઠળ ચૂંટણી પછીની પ્રથમ સામાન્ય સભામાં મેયરની પસંદગી કરવામાં આવે છે. તેવી જ રીતે આ મિટીંગમાં ઘી જી.પી.એમ.સી. એક્ટ, ૧૯૪૯ ની કલમ-૨૦ હેઠળ સ્થાયી સમિતિના ૧૨(બાર) સભ્યોની નિમણૂંક/પસંદગી કરવામાં આવે છે. ઘી જી.પી.એમ.સી. એક્ટ, ૧૯૪૯ ની કલમ-૨૧(૧) ની જોગવાઈ હેઠળ સ્થાયી સમિતિના ૧૨(બાર) સભ્યોમાંથી કોઈ ૧(એક) સદસ્યની સ્થાયી સમિતિની પ્રથમ મિટીંગમાં અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવે છે. સામાન્ય સભા, સ્થાયી સમિતિ અને ખાસ/તદ્દર્થ સમિતિઓને મ્યુ.કમિશનર ધ્વારા રજુ કરાયેલ દરખાસ્તો અંગે નિર્ણય કરવાની સત્તા આપવામાં આવી છે. સામાન્ય સભા, સ્થાયી સમિતિ, ખાસ સમિતિઓ અને તદ્દર્થ સમિતિની કાર્યવાહીઓનું સંચાલન સેક્રેટરી ઓફિસ ધ્વારા કરવામાં આવે છે. સેક્રેટરી વિભાગના વહીવટને લગતા સત્તાધિકારી મ્યુનિસિપલ સેક્રેટરી છે.
- ઘી જી.પી.એમ.સી.એક્ટ,૧૯૪૯ ની કલમ-૩૦ ની જોગવાઈઓ હેઠળ ખાસ સમિતિઓ/તદ્દર્થ સમિતિ અસ્તિત્વમાં આવે છે અને ખાસ સમિતિઓ/તદ્દર્થ સમિતિની સભા યોજવા/બોલાવવા માટેના નિયમો/વિનિયમો ઘી જી.પી.એમ.સી.એક્ટ,૧૯૪૯ ની કલમ-૪૫૭ ની પેટા કલમ-૧ અને ૨ ની જોગવાઈઓને આધિન "જુદી જુદી ખાસ સમિતિઓના સભા સંચાલનના નિયમો ૧૯૮૯" ની પુસ્તિકામાં દર્શાવેલ છે. ([એનેક્ષર-૨](#) અને [એનેક્ષર-૨.૧](#))

- ખાસ સમિતિઓની સત્તા, કાર્યો અને ફરજો સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભાના મંજૂર થયેલ વિવિધ ઠરાવો અન્વયે તેમજ જુદી જુદી ખાસ સમિતિઓના સભા-સંચાલનના નિયમો ૧૯૮૯ ની પુસ્તિકામાં દર્શાવેલ વિગતો મુજબ ધી જી.પી.એમ.સી. એક્ટ, ૧૯૪૯ ની વિવિધ કલમો હેઠળ રચાયેલ છે. ([એનેક્ષર-૩](#), [એનેક્ષર-૩.૧](#), [એનેક્ષર-૩.૨](#), [એનેક્ષર-૩.૩](#))
- સેક્રેટરી વિભાગ ધ્વારા સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા, સ્થાયી સમિતિ, વિવિધ ખાસ સમિતિ અને તદ્દર્થ સમિતિ ધ્વારા કરવામાં આવેલ એજન્ડા-ઠરાવના રેકર્ડની નકલની નિભાવણી જે તે વર્ષ પ્રમાણે-ઠરાવ ક્રમાંક પ્રમાણે કરવામાં આવે છે. સદર રેકર્ડની નિભાવણી જુદી જુદી બાબતેના વિષય/ખાતા/વિભાગ પ્રમાણે કરવામાં આવતી નથી. વધુમાં પ્રો-એક્ટીવ ડીસકલોઝર હેઠળ સેક્રેટરી વિભાગને લગતી માહિતી સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.

મુદા નં.૪ (૧)(ખ) (૨) સેક્રેટરી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો:-

(૧) મ્યુ.સેક્રેટરી:-

- ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ(અધિનિયમ)૧૯૪૯ ની કલમ-૪૮ અન્વયે મ્યુ.સેક્રેટરીએ પોતાની સત્તા અને ફરજો બજાવવાની રહે છે. સુરત મહાનગરપાલિકાના સેક્રેટરી તરીકેના નેતૃત્વ હેઠળ તેમના તાબા હેઠળના અધિકારી/કર્મચારીઓ પાસેથી સેક્રેટરી ઓફિસને લગતી તમામ પ્રકારની કામગીરી લઈ તેના ઉપર દેખરેખ રાખી માર્ગદર્શન પુરું પાડવાનું રહે છે. ([એનેક્ષર-૪](#))

સેક્રેટરી ઓફિસના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની ફરજો નીચે મુજબ છે :-

(૨) ડેપ્યુટી સેક્રેટરી:-

- મ્યુનિસિપલ સેક્રેટરીશ્રીની ગેરહાજરીના પ્રસંગે મ્યુ.સેક્રેટરીની કામગીરી મ્યુ.સેક્રેટરીશ્રી વતી કરવી. આર.ટી.આઈ.એક્ટ-૨૦૦૫ હેઠળ સેક્રેટરી ઓફિસના એપેલેટ ઓફિસર તરીકે ફરજ બજાવવી. જનરલ બોર્ડ, સ્થાયી સમિતિ, ખાસ સમિતિઓ અને તદ્દર્થ સમિતિના ડે.સેક્રેટરી તરીકે ફરજ બજાવવી. સેક્રેટરી ઓફિસની સમગ્ર વહીવટી કામગીરી તેમજ પટાવાળા થી આસીસ્ટન્ટ સેક્રેટરી સુધીના તમામ અધિકારી/કર્મચારીઓની કામગીરીનું સુપરવિઝન કરવું. સુરત મહાનગરપાલિકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યની ચૂંટણીની તમામ કામગીરીનું સુપરવિઝન કરવું. તેમજ જે-તે પદાધિકારીશ્રીઓની કચેરીમાં ફરજ બજાવવી. નિયત કરેલ કોમ્પ્યુટર પ્રોગ્રામમાં પદાધિકારીશ્રીઓને રોજબરોજ મળતા આમંત્રણ પત્રિકા, કાર્ડ, ખાત મુહૂર્ત, ભૂમિ પુજન, ઉદ્ઘાટન સમારોહ વિગરે બાબતેની માહિતી મંગાવવી અને તે અન્વયે કાર્યક્રમની ડાયરી તૈયાર કરાવવી, કચેરીમાં જુદી જુદી બાબતેના રજીસ્ટર નિભાવવા, પદાધિકારીશ્રીના આદેશ/માર્ગદર્શન મુજબ સ્ટેનો/ટાઈપીંગ કરાવવાની કામગીરી, કચેરીમાં આવતા ફોન રીસીવ કરવા તેમજ પદાધિકારીશ્રીના આદેશ મુજબ યોગ્ય સ્થળે ફોન કરવાની કામગીરી, પદાધિકારીશ્રી સાથે મીટીંગમાં મદદનીશ તરીકે હાજર રહી તેને સુસંગત કામગીરી અને કચેરીમાં આવતા મુલાકાતીઓની સમસ્યા/પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવા વિગરે બાબતેની કામગીરી કરવાની રહે છે. પદાધિકારીશ્રીઓ તરફથી સુચવવામાં આવતી તમામ કામગીરી કરવી. પદાધિકારીશ્રીઓ પ્રતિ ઉદ્દેશીને આવતા તમામ પત્રોના આવક જાવક અંગેની કામગીરી કરાવવી.

(૩) પી.એ.ટુ.મેયર:—

➤ મા.મેયરશ્રીની કચેરીમાં મદદનીશ તરીકે ફરજ બજાવવી. મા.મેયરશ્રી તરફથી સુચવવામાં આવતી તમામ કામગીરી કરવી. મેયર્સફંડ બાબતેની ફાઈલોના આવક—જાવકની કામગીરી તેમજ તેને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવું. મા.મેયરશ્રી તરફથી અપાતા આવકના દાખલા બનાવીને આપવા તેમજ સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોમાં સારવાર મેળવનાર ગરીબ દર્દીઓને મા.મેયરશ્રીની સુચના અનુસાર બીલમાં માફીના દાખલા બનાવીને આપવાની કામગીરી કરાવવી. મા.મેયરશ્રી સુરત મહાનગરપાલિકાને ઉદ્દેશીને આવતા તમામ પત્રોના આવક જાવક અંગેની કામગીરી, આમંત્રણ પત્રિકા, કાર્ડ, ખાત મુહૂર્ત/ભૂમિ પુજન/ઉદ્ઘાટન સમારોહ વિગરે બાબતેની માહિતી મંગાવવી અને તે અન્વયે કાર્યક્રમની ડાયરી તૈયાર કરવી, કચેરીમાં જુદી જુદી બાબતેના રજીસ્ટર નિભાવવા, કચેરીમાં આવતા ફોન રીસીવ કરવા તેમજ આદેશ મુજબ યોગ્ય સ્થળે ફોન કરવાની કામગીરી, મીટીંગમાં મદદનીશ તરીકે હાજર રહી તેને સુસંગત કામગીરી કરવી અને કચેરીમાં આવતા મુલાકાતીઓની સમસ્યા/પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવા વિગરે બાબતેની કામગીરી કરવાની રહે છે.

(૪) અંગત મદદનીશ:—

➤ જે તે પદાધિકારીશ્રીઓના સુરત મહાનગરપાલિકા તરફના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવવી. પદાધિકારીશ્રીઓની કચેરીમાં ફરજ બજાવવાની રહે છે. નિયત કરેલ કોમ્પ્યુટર પ્રોગ્રામમાં પદાધિકારીશ્રીને રોજબરોજ મળતા આમંત્રણ પત્રિકા, કાર્ડ, ખાત મુહૂર્ત, ભૂમિ પુજન, ઉદ્ઘાટન સમારોહ વિગરે બાબતેની માહિતી મંગાવવી અને તે અન્વયે કાર્યક્રમની ડાયરી તૈયાર કરવી, કચેરીમાં જુદી જુદી બાબતેના રજીસ્ટર નિભાવવા, પદાધિકારીશ્રીના આદેશ/માર્ગદર્શન મુજબ સ્ટેનો/ટાઈપીંગ કરવાની કામગીરી, કચેરીમાં આવતા ફોન રીસીવ કરવા તેમજ પદાધિકારીશ્રીના આદેશ મુજબ યોગ્ય સ્થળે ફોન કરવાની કામગીરી, પદાધિકારીશ્રી સાથે મીટીંગમાં મદદનીશ તરીકે હાજર રહી તેને સુસંગત કામગીરી અને કચેરીમાં આવતા મુલાકાતીઓની સમસ્યા/પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવા વિગરે બાબતેની કામગીરી કરવાની રહે છે.

(૫) આસીસ્ટન્ટ સેક્રેટરી:—

➤ સામાન્ય સભા, સ્થાયી સમિતિ, વિવિધ ખાસ સમિતિઓ અને તદ્દર્થ સમિતિઓના આસીસ્ટન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવવી. જે સમિતિની જવાબદારી સોંપવામાં આવે તે સમિતિના પ્રોસીડીંગ રાઈટર ધ્વારા તૈયાર કરવામાં આવતા જે તે મીટીંગના એજન્ડા/ઠરાવોની ચકાસણી કરી વિભાગીય વડા(મ્યુ.સેક્રેટરી) સમક્ષ રજુ કરી તેમની સહી થયેથી એજન્ડા પ્રસિધ્ધ કરાવવાની/ઠરાવ કરી તેને ડીસ્પેચ કરાવવાની કામગીરી કરવી. જે તે સમિતિની કાર્યરીતિને અનુરૂપ મુવના ઠરાવ ફાઈનલ કરવા તેમજ એજન્ડા પ્રેસમાં પ્રસિધ્ધ કરવા બાબતની કામગીરી. જે સમિતિની જવાબદારી સોંપવામાં આવેલ હોય તેની મીટીંગમાં હાજર રહી કાચી મીનીટ્સ તૈયાર કરવા સહિત મીટીંગને અનુરૂપ તમામ કામગીરી, સમિતિના કાર્યક્ષેત્રને લાગત પત્રો બાબતે માર્ગદર્શન પુરૂ પાડી તેના નિકાલ કરાવવાની કામગીરી, સમિતિની મીનીટ્સ ફાયનલ કરવામાં મદદરૂપ થવા અંગેની કામગીરી તેમજ જે તે સમિતિના અધ્યક્ષશ્રીઓને મીટીંગ/કામ બાબતે નિયમોનુસાર યોગ્ય તે નિર્ણય લેવા માટે માર્ગદર્શન પુરૂ પાડવાની કામગીરી તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યની ચૂંટણીની તમામ કામગીરી કરવી અને આર.ટી.આઈ.એક્ટ-૨૦૦૫ હેઠળ એપેલેટ ઓફિસર તરીકેની કામગીરી તેમજ જાહેર માહિતી અધિકારી તરીકેની કામગીરી, જેમાં અરજદારની અરજી/અપીલ અંગે સેક્રેટરી ઓફિસના ઉપલબ્ધ રેકર્ડના આધારે નિયત સમયમર્યાદામાં અરજદારને તેમની અરજી/અપીલ અંગે જવાબ પાઠવવાની કામગીરી કરવાની રહે છે.

(૬) આસીસ્ટન્ટ સેક્રેટરી(સેક્શન ઓફિસર):-

➤ સેક્રેટરી ઓફિસના વહીવટને લગતી સમગ્ર બાબતોનું સંચાલન અને સુપરવિઝન કરવાની કામગીરી જેમાં એસ્ટાબ્લીશમેન્ટ વિભાગમાં મહેકમને લગતી કર્મચારીઓની બાબતો જેવી કે, કર્મચારીઓની હાજરી, સર્વિસબુક, ખાનગી અહેવાલ, પગાર/પેન્શન/ગ્રેજ્યુઈટી, રજા/રજા પગાર, એલ.ટી.સી.લીવ એન્કેશમેન્ટ/રીઈમ્બર્સમેન્ટ, મેમો-કારણદર્શક નોટીસ, સ્વૈચ્છિક નિવૃત્તિ/વય નિવૃત્તિ/અવસાન/નોકરીના અંત સુધીની તમામ બાબતની કામગીરી કરાવવી, અન્ય ઓફિસોમાં પત્રવ્યવહારની કામગીરી ઉપરાંત સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરોની મીટીંગની હાજરી અન્વયે ભથ્થા બીલ બનાવડાવી તેઓને માનદવેતન અને અન્ય મળવાપાત્ર ભથ્થાઓ ચુકવવા અંગેની કામગીરી કરાવવી, ઓફિસમાં જરૂરીયાત મુજબ કામની જગ્યાએ સ્ટાફની વ્યવસ્થા/ગોઠવણી કરવી, સ્ટોર્સને લગતી કામગીરી જેમાં ઓફિસમાં ખરીદી કરાતી તમામ ચીજવસ્તુઓ, ઓફિસના તાબા હેઠળના સભાખંડો, કોમ્પ્યુટરો, યુનીફોર્મ/સ્ટેશનરી આઈટમોની નિભાવણી કરવાની કામગીરી કરાવવી, કચેરીના કોપી પ્રિન્ટર/ઝેરોક્ષ મશીનોની નિભાવણી માટે એ.એમ.સી./એ.આર.સી.ની કામગીરી કરાવવી, સેક્રેટરી ઓફિસના અધિકારી/કર્મચારીઓનું સીનીયોરીટી લીસ્ટ તૈયાર કરવાની અને નિભાવવાની કામગીરી, સેક્રેટરી ઓફિસનું રોસ્ટર રજીસ્ટર તૈયાર કરવાની અને નિભાવવાની કામગીરી કરવી. એકાઉન્ટને લગતી બાબતો જેવી કે, પર્સનલ એડવાન્સ અને જનરલ એડવાન્સ રીક્રુટમેન્ટ બીલ વિગેરે બનાવવાની કામગીરી કરાવવી, મે.મ્યુ.કમિશનરશ્રીના તાબા હેઠળની સેન્ટ્રલ ઓફિસમાંથી આવતી વિવિધ કામો અંગેની ફાઈલો વિ.ને ઈનવર્ડ/આઉટવર્ડ કરવા અંગેની ડીસ્પેચની કામગીરી તેમની સીધી દેખરેખ/માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. સામાન્ય રીતે આસીસ્ટન્ટ સેક્રેટરીની ગેરહાજરી દરમિયાન તેમની કામગીરી પણ કરવાની રહે છે. તેમના તાબા હેઠળના કર્મચારીઓ/સ્ટાફને માર્ગદર્શન પુરું પાડવાની કામગીરી કરવાની રહે છે. સુરત મહાનગરપાલિકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણીની તમામ કામગીરી કરવી તથા સેક્રેટરી ઓફિસના તાબા હેઠળના સભાખંડોમાં યોજવામાં આવતી મીટીંગ વખતે વહીવટને લગતી કામગીરી જેવી કે, સભાખંડોની સાફ-સફાઈ કરાવવી, મીટીંગ દરમિયાન બેઠક વ્યવસ્થા, કર્મચારીઓ/પટાવાળાઓની વ્યવસ્થા કરવા સહિતની તમામ કામગીરી.

(૭) સ્ટેનોગ્રેડ-૧:-

➤ પી.એ.ટુ મેયરશ્રી તેમજ અંગત મદદનીશ ધ્વારા આપવામાં આવતી સુચના અન્વયેની કામગીરી તેમજ પી.એ.ટુ મેયરશ્રી અને અંગત મદદનીશ અને સ્ટેનો ગ્રેડ-૧ની ગેરહાજરી વખતે તેઓની કામગીરીનો ચાર્જ સંભાળવાનો રહે છે. સુચના અનુસાર જે તે પદાધિકારીશ્રીઓની કચેરીમાં પણ ફરજ બજાવવાની રહે છે. સામાન્ય સભાની મીનીટસ તૈયાર કરવાની કામગીરી, પદાધિકારીશ્રી તરફથી આપવામાં આવતી સુચના અનુસારની કામગીરી, કચેરીમાં આવતા પત્રોના ઈનવર્ડ તેમજ આઉટવર્ડ અંગેની કામગીરી, પદાધિકારીશ્રીઓની સુચના અનુસાર વિવિધ બાબતો અંગેની નોંધ તેમજ મે.કમિશનરશ્રી,વિભાગીય વડા/ખાતાધિકારીશ્રી વિ.ને પત્રો લખવાની કામગીરી. કચેરીમાં જુદી જુદી બાબતોના રજીસ્ટર નિભાવવા, કચેરીમાં આવતા ફોન રીસીવ કરવા તેમજ પદાધિકારીશ્રીના આદેશ અને સુચના મુજબ યોગ્ય સ્થળે ફોન કરવાની અને માહિતી મેળવવાની કામગીરી. પદાધિકારીશ્રીની સુચના મુજબ પદાધિકારીશ્રી સાથે મીટીંગમાં મદદનીશ તરીકે હાજર રહી તેને સુસંગત કામગીરી. પદાધિકારીશ્રીની કચેરીમાં આવતા મુલાકાતીઓની સમસ્યા/પ્રશ્નો/રજુઆતોના નિરાકરણ માટે યોગ્ય માર્ગદર્શન પુરું પાડવું વિગેરે કામગીરી કરવાની રહે છે.

(૮) હેડ કલાર્ક:-

➤ સેક્રેટરી ઓફિસના અન્ય ખાતા/કચેરી સાથેના પત્રવ્યવહાર તથા વિવિધ માહિતી એકત્રીકરણ/સંકલન કરવાની કામગીરી, મહેકમ શિડયુલ, પેન્શનરો અંગેની ફાઈલ, સર્વિસ બુક, ખાનગી અહેવાલ, સ્થાયી તથા અન્ય હુકમોની ફાઈલો, શિક્ષાત્મક કાર્યવાહીઓ, મુવમેન્ટ રજીસ્ટર, પગાર, ભથ્થા, હિસાબી તમામ કામગીરીનું સુપરવિઝન કરી પેમેન્ટ બીલો-જનરલ એડવાન્સ રીકુપમેન્ટ-ટ્રેઝરી વિભાગની કામગીરી-ઓફિસના બજેટની કામગીરી-લીવ ઈન્ફીમેન્ટના ડેટા-પગારના ડેટા-ફીક્સેશનની, તદ્દર્થ સમિતિને લગતા કામોની, મહેકમ તદ્દર્થ સમિતિના કામોની અને સ્ટોર્સને લગતા કામોની, કર્મચારીઓના હાજરી પત્રકની, વિવિધ રજાના રીપોર્ટની ચકાસણી કરવી વિગેરે કામગીરી સેક્શન ઓફિસરની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવે છે. આ ઉપરાંત તદ્દર્થ સમિતિના પ્રોસીડીંગ રાઈટર તરીકે પણ ફરજ બજાવવાની રહે છે.

(૯) પ્રથમ શ્રેણી કલાર્ક:-

➤ સામાન્ય રીતે વહીવટી સરળતા ખાતર કામગીરીમાં એકરાગીતા, ચોકસાઈ રહે તે માટે પ્રથમ શ્રેણી કલાર્ક પ્રોસીડીંગ રાઈટર જનરલ બોર્ડ/સ્થાયી સમિતિ/ખાસ સમિતિઓ/તદ્દર્થ સમિતિ અથવા હેડકલાર્ક તરીકે ફરજ બજાવવાની રહે છે. સેક્શન ઓફિસર/હેડ કલાર્કની ગેરહાજરીમાં પ્રથમ શ્રેણી કલાર્ક ફરજ બજાવવાની રહે છે. જે તે સમિતિના મદદનીશ સ્ટાફને માર્ગદર્શન પુરું પાડવું, મીટીંગ અંગેની માહિતી એકત્રીત કરવી, સમિતિઓને લાગત માંગવામાં આવતી માહિતી પુરી પાડવી, તાબા હેઠળના કર્મચારીઓના તેમજ મદદનીશ ધ્વારા પ્રાથમિક તબક્કે તૈયાર થયેલ સમિતિના એજન્ડા ફાયનલ કરી વિભાગીય વડા સમક્ષ રજૂ કરી તેમની સહી થયેથી એજન્ડા પ્રસિધ્ધ કરાવવાની તેમજ ઠરાવો પણ તૈયાર કરી વિભાગીય વડા સમક્ષ રજૂ કરી તેમની સહી થયેથી નિયત જગ્યાએ રવાના કરાવવા, સમિતિની મીટીંગમાં હાજર રહી ડ્રાફ્ટ મીનીટ્સ તૈયાર કરી મીનીટ્સ ફાયનલ કરવાની કામગીરી અને આર.ટી.આઈ.એક્ટ-૨૦૦૫ હેઠળ મદદનીશ જાહેર માહિતી અધિકારી તરીકેની કામગીરી કરવી.

(૧૦) સ્ટેનોગ્રેડ-૨:-

➤ પી.એ.ટુ મેયરશ્રી તેમજ અંગત મદદનીશ ધ્વારા આપવામાં આવતી સુચના અન્વયેની કામગીરી તેમજ પી.એ.ટુ મેયરશ્રી અને અંગત મદદનીશ અને સ્ટેનો ગ્રેડ-૧ની ગેરહાજરી વખતે તેઓની કામગીરીનો ચાર્જ સંભાળવાનો રહે છે. સુચના અનુસાર જે તે પદાધિકારીશ્રીઓની કચેરીમાં પણ ફરજ બજાવવાની રહે છે. સામાન્ય સભાની રફ મીનીટ્સની ચકાસણી/એપ્રુવલ તથા તેને ફાયનલ કર્યા બાદ ફેર(ડ્રાફ્ટ) મીનીટ્સ સુધારા/વધારા સહિત ફાયનલ કરવા/કરાવવાની સંપૂર્ણ કામગીરી કરવી, પદાધિકારીશ્રી તરફથી આપવામાં આવતી સુચના અનુસારની કામગીરી, કચેરીમાં આવતા પત્રોના ઈનવર્ડ તેમજ આઉટવર્ડ અંગેની કામગીરી, પદાધિકારીશ્રીઓની સુચના અનુસાર વિવિધ બાબતો અંગેની નોંધ તેમજ મે.કમિશનરશ્રી, વિભાગીય વડા/ખાતાધિકારીશ્રી વિ.ને પત્રો લખવાની કામગીરી. ખાસ સમિતિઓના પ્રોસીડીંગ રાઈટરોની કામગીરીનું સુપરવિઝન કરવું/ખાસ સમિતિના આસીસ્ટન્ટ સેક્રેટરીની કામગીરી કરવી. કચેરીમાં જુદી જુદી બાબતોના રજીસ્ટર નિભાવવા, કચેરીમાં આવતા ફોન રીસીવ કરવા તેમજ પદાધિકારીશ્રીના આદેશ અને સુચના મુજબ યોગ્ય સ્થળે ફોન કરવાની અને માહિતી મેળવવાની કામગીરી. પદાધિકારીશ્રીની સુચના મુજબ પદાધિકારીશ્રી સાથે મીટીંગમાં મદદનીશ તરીકે હાજર રહી તેને સુસંગત કામગીરી. પદાધિકારીશ્રીની કચેરીમાં આવતા મુલાકાતીઓની સમસ્યા/પ્રશ્નો/રજૂઆતોના નિરાકરણ માટે યોગ્ય માર્ગદર્શન પુરું પાડવું વિગેરે કામગીરી કરવાની રહે છે.

(૧૧) બીજી શ્રેણી કલાર્ક:—

બીજી શ્રેણી કલાર્ક ખાસ સમિતિના પ્રોસીડીંગ રાઈટર તરીકે અથવા એસ્ટાબ્લીશમેન્ટ કલાર્ક તેમજ જનરલ બોર્ડ/સ્થાયી સમિતિના પ્રોસીડીંગ રાઈટરના મદદનીશ તરીકે ફરજ બજાવવાની રહે છે. પ્રોસીડીંગ રાઈટર તરીકે એજન્ડા તૈયાર કરવા, ઠરાવો અને મુવના ઠરાવો તૈયાર કરવા, ઠરાવો ફાયનલ કરવા સહિતની જે તે સમિતિની સંપૂર્ણ કામગીરી કરવાની રહે છે. જ્યારે પ્રોસીડીંગ રાઈટરના મદદનીશ તરીકે તેમના માર્ગદર્શન હેઠળ કાર્યક્ષેત્રમાં આવતી બાબતોમાં મદદરૂપ થવાની કામગીરી કરવાની રહે છે. એસ્ટાબ્લીશમેન્ટ વિભાગમાં હેડ કલાર્ક/સેક્શન ઓફિસરના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓના પગાર, રજા, એલ.ટી.સી. વિગેરેને લગતી તમામ કામગીરી કરવાની રહે છે.

(૧૨) સ્ટેનોગ્રેડ—૩:—

➤ પી.એ.ટુ મેયરશ્રી, અંગત મદદનીશશ્રી, સ્ટેનો ગ્રેડ—૧, સ્ટેનો ગ્રેડ—૨ ના મદદનીશ તરીકે તેઓ ધ્વારા આપવામાં આવતી સુચના અન્વયે તેમની તમામ કામગીરીમાં મદદ કરવી અને તેઓની ગેરહાજરી વખતે ઉપરી અધિકારી ધ્વારા સુચના મળ્યેથી તેમની જગ્યાનો ચાર્જ સંભાળવાનો રહે છે. સુચના અનુસાર જે તે પદાધિકારીશ્રીઓની કચેરીમાં પણ ફરજ બજાવવાની રહે છે. સામાન્ય સભાની મીનીટસ તૈયાર કરવાની કામગીરી કરવી, ખાસ સમિતિઓના પ્રોસીડીંગ રાઈટરની કામગીરી કરવી, પદાધિકારીશ્રી તરફથી આપવામાં આવતી સુચના અનુસારની કામગીરી કરવી, કચેરીમાં આવતા પત્રોના ઈનવર્ડ તેમજ આઉટવર્ડ અંગેની કામગીરી કરવી, પદાધિકારીશ્રીઓની સુચના અનુસાર વિવિધ બાબતો અંગેની નોંધ તેમજ પત્રો લખવાની કામગીરી. કચેરીમાં જુદી જુદી બાબતોના રજીસ્ટર નિભાવવા, કચેરીમાં આવતા ફોન રીસીવ કરવા તેમજ પદાધિકારીશ્રીના આદેશ અને સુચના મુજબ યોગ્ય સ્થળે ફોન કરવાની અને માહિતી મેળવવાની કામગીરી કરવી. પદાધિકારીશ્રીની કચેરીમાં આવતા મુલાકાતીઓની સમસ્યા/પ્રશ્નો/રજૂઆતોના નિરાકરણ માટે યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવું વિગેરે કામગીરી કરવી અને મ્યુ.સભ્યશ્રીઓના પત્રો ટાઈપીંગ કરવાની કામગીરી કરવાની રહે છે.

(૧૩) ત્રીજી શ્રેણી કલાર્ક:—

➤ ત્રીજી શ્રેણી કલાર્ક સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ, સામાન્ય સભા, વિવિધ ખાસ સમિતિ અને તદ્દર્થ સમિતિમાં અને એસ્ટાબ્લીશમેન્ટ/એકાઉન્ટ વિભાગ, સ્ટોર વિભાગ, ડીસ્પેચ વિભાગ તેમજ જુદા જુદા પદાધિકારીશ્રીઓની કચેરીમાં ફરજ બજાવવાની રહે છે. સમિતિમાં એજન્ડા, ઠરાવના ડ્રાફ્ટ ટાઈપ કરવા, પકકા પ્રોસીડીંગ બુકમાં મીનીટ્સ લખવાની, ઠરાવ ડીસ્પેચ કરવાની, સમિતિના રેકર્ડ નિભાવવાની, નિયત કરેલ જુદા જુદા કોમ્પ્યુટર પ્રોગ્રામમાં એન્ટ્રી કરવા જેવી તમામ કામગીરી કરવાની રહે છે. એસ્ટાબ્લીશમેન્ટ વિભાગમાં હેડ કલાર્ક કે સેક્શન ઓફિસરના કાર્યક્ષેત્રમાં આવતી હોય તેવી પગાર, ભથ્થા, રીપોર્ટ, સર્વિસ બુક, ખાનગી અહેવાલ વિગેરેની કામગીરી તેમજ તેની કોમ્પ્યુટર પ્રોગ્રામમાં એન્ટ્રી પણ કરવાની રહે છે. જુદા જુદા પદાધિકારીશ્રીઓની કચેરીમાં ફરજ નિભાવતી વખતે પી એ ટુ મેયરશ્રી અને અંગત મદદનીશના માર્ગદર્શન હેઠળ કચેરીને સુસંગત સોંપવામાં આવે તેવી ટાઈપીંગની તથા પત્રો ઈનવર્ડ આઉટવર્ડ કરવા જેવી તમામ કામગીરી કરવાની રહે છે. એકાઉન્ટને લગતી કામગીરી

જેવી કે પર્સનલ એડવાન્સ અને જનરલ એડવાન્સ રીકુપમેન્ટ બીલ બનાવવા, સમિતિઓની મીટીંગ યોજાય ત્યારે પર્સનલ એડવાન્સમાંથી પેમેન્ટ કરવાની કામગીરી કરવાની રહે છે. ડીસ્પેચની કામગીરી જેવી કે મ્યુ.કમિશનરશ્રીના તાબા હેઠળની સેન્ટ્રલ ઓફિસમાંથી આવતી તમામ ફાઈલો, પરિપત્રો, નોંધ વિગેરે ઈનવર્ડ/આઉટવર્ડ કરવાની કામગીરી કરવાની રહે છે. સેક્રેટરી ઓફિસ અને સેક્રેટરી ઓફિસના તાબા હેઠળની ઓફિસોમાં સ્ટેશનરી આઈટમ, જાહેર બજારમાંથી જુદી-જુદી ચીજવસ્તુઓની ખરીદી કરી તેની ખતવણી કરી જે તે ઓફિસમાં પુરી પાડવાની કામગીરી, કોપી પ્રિન્ટર/ઝેરોક્ષ મશીનોની નિભાવણીની કામગીરી તેમજ આર.ટી.આઈ.એક્ટ હેઠળ મદદનીશની કામગીરી કરવાની રહે છે.

(૧૪) નાયક/જમાદાર:—


- સામાન્ય સભા, સ્થાયી સમિતિ, સ્થાયી સમિતિની પેટા સમિતિ તથા ખાસ સમિતિઓના તેમજ તદ્દર્થ સમિતિઓના એજન્ડા, મીનીટ્સ, બજેટની બુક વિગેરે મ્યુ.સદસ્યશ્રીઓને પહોંચાડવી તેમજ તે પહોંચાડવાની વ્યવસ્થા કરવી. પદાધિકારીશ્રીઓ તથા વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ/સભ્યશ્રીઓના બેલ એટેન્ડ કરવા તથા તેઓ તરફથી જે કામગીરી સોંપવામાં આવે તે કામગીરી કરવી/કરાવવી. જે તે સમિતિઓની મીટીંગમાં હાજર રહી ઉપરી અધિકારીઓ તરફથી આપવામાં આવતી સુચના મુજબ કામગીરી કરવી/કરાવવી. કમિટીરૂમમાં મુકવામાં આવેલ સામાન્ય સભા તથા સ્થાયી સમિતિના કામોની ફાઈલો તથા કમિટીરૂમની દેખરેખ રાખવી/રખાવવી. કમિટીરૂમ, સ્થાયી સમિતિ સભાખંડ તથા સરદાર વલ્લભભાઈ પટેલ સભાગૃહ, પ્રેક્ષક ગેલેરીની સાફસફાઈ તથા ટોયલેટ અને પેન્ટ્રીની નિયમિત રીતે સાફસુફી થાય છે કે કેમ તેની દેખરેખ રાખવી. સેક્રેટરી ઓફિસના તમામ પટાવાળાઓની કામગીરી ઉપર દેખરેખ રાખવી. સેક્રેટરી ઓફિસના પટાવાળાઓ પૈકી જો કોઈ પટાવાળા ગેરહાજર હોય તેવા પ્રસંગે અન્ય પટાવાળાઓની વૈકલ્પિક વ્યવસ્થા કરવી. જો ઓફિસને લગતી બહારની ફરજ સોંપવામાં આવે તો તે ફરજ બજાવવી તથા ઓફિસને લગતી બહારની ફરજ બજાવવા અંગેની વ્યવસ્થા કરવી. આ ઉપરાંત પરિસ્થિતિને આધિન મ્યુ.સેક્રેટરીશ્રી તથા ઓફિસના અન્ય ઉપરી અધિકારીશ્રીઓ ધ્વારા આપવામાં આવતી સુચનાઓ મુજબની કામગીરી કરવી/ફરજ બજાવવી.

(૧૫) પટાવાળા:—

- સામાન્ય સભા, સ્થાયી સમિતિ, સ્થાયી સમિતિની પેટા સમિતિ તથા ખાસ સમિતિઓ તેમજ તદ્દર્થ સમિતિઓના એજન્ડા, મીનીટ્સ, બજેટની બુક વિગેરે મ્યુ.સદસ્યશ્રીઓને પહોંચાડવાની કામગીરી તથા તેની પહોંચ લાગત અધિકારીશ્રીને તુરંત જમા કરાવવાની કામગીરી. પદાધિકારીશ્રીઓ તથા વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ/સભ્યશ્રીઓના બેલ એટેન્ડ કરવા તથા તેઓ તરફથી જે કામગીરી સોંપવામાં આવે તે કામગીરી કરવી. જે તે સમિતિઓની મીટીંગમાં હાજર રહી નાયક/જમાદાર તથા ઉપરી અધિકારીઓ તરફથી આપવામાં આવતી સુચના મુજબ કામગીરી કરવી. કમિટીરૂમમાં સામાન્ય સભા તથા સ્થાયી સમિતિના મુકવામાં આવેલ કામોની ફાઈલો તથા કમિટીરૂમની દેખરેખ રાખવી. કમિટીરૂમ, સ્થાયી સમિતિ સભાખંડ તથા સરદાર વલ્લભભાઈ પટેલ સભાગૃહની તેમજ જુદી-જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓની કચેરીમાં પાણી,

નેપકીન, ખુરશીઓ વિ.ની જરૂરીયાત મુજબ વ્યવસ્થા/ગોઠવણી કરવી. નાયક/જમાદારની સુચના મુજબ જે તે પટાવાળાએ ઓફિસ ખોલવાની તથા બંધ કરવાની ફરજ બજાવવી. ઓફિસની બહારની ટપાલ પહોંચાડવા અંગેની ફરજ બજાવવી તથા જો કોઈ પટાવાળા રજા પર હોય તો તે દિવસોએ તેઓના પણ એજન્ડા, મીનીટસ વિગેરે પહોંચાડવાની બહારની ફરજ બજાવવી. ઓફિસના ઉપરી અધિકારીશ્રી/કર્મચારીઓ ધ્વારા આપવામાં આવતી ટપાલ યોગ્ય જગ્યાએ પહોંચાડવાની કામગીરી કરવી. ઓફિસમાં જે પટાવાળા રજા ઉપર હોય તેમની જગ્યાએ રીલીવર તરીકે ફરજ બજાવવી. આ ઉપરાંત પરિસ્થિતિને આધિન મ્યુ.સેક્રેટરીશ્રી તથા ઓફિસના અન્ય ઉપરી અધિકારીશ્રીઓ ધ્વારા આપવામાં આવતી સુચનાઓ મુજબની કામગીરી કરવી/ફરજ બજાવવી.

મુદ્દા નં.૪(૧) (ખ) (૩) : દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ:—



મુદ્દા નં.૪(૧)ખ(૪) :પોતાના કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો.

ધી જી.પી.એમ.સી. એક્ટ સને ૧૯૪૯(હવે ધી જી.પી.એમ.સી. એક્ટ), ગુજરાત રાજ્ય સેવા(વર્તણુંક) નિયમો સને ૧૯૭૧, ગુજરાત રાજ્ય સેવા(શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧, સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિ, સામાન્ય સભાએ વખતો વખતના ઠરાવથી પાસ કરેલ નિયમો-ઠરાવો, મ્યુનિ. કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકા તેમજ રાજ્ય સરકારશ્રી ધ્વારા વખતો વખત જાહેર થતા પરિપત્રો-ઠરાવોમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ કામગીરી કરવી.

મુદ્દા નં.૪(૧)ખ(૫) પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહો અને રેકર્ડ

- જી.પી.એમ.સી.એક્ટ – ૧૯૪૯
- મહાનગરપાલિકા અને સ્થાયી સમિતિની સભાઓની કાર્યવાહી અંગેના નિયમો ૧૯૮૦ અને જુદી જુદી ખાસ સમિતિઓના સભા સંચાલનના નિયમો.
- ગુજરાત રાજ્ય સેવા(વર્તણુંક) નિયમો સને ૧૯૭૧
- ગુજરાત રાજ્ય સેવા(શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧
- પેન્શન – નિયમો
- ગુજરાત મુલકી સેવા (પેન્શન) નિયમો સને ૨૦૦૨ નો પરિચય
- ગુજરાત મુલકી સેવા (મુસાફરી ભથ્થુ) નિયમો, ૨૦૦૨ નો પરિચય
- જી.સી.એસ.આર. – ૨૦૦૨
- ખાતાકીય તપાસના નિયમો
- નોકરીની સામાન્ય શરતોના નિયમો, ૨૦૦૨
- ગુજરાત મુલકી સેવા (પગાર) નિયમો સને ૨૦૦૨ના પરિચય
- ખાતાકીય તપાસ, ૯/૧૮/૨૭, નાણાકીય, વર્તણુંક, શિસ્ત, પગાર, રજા વિગેરે નિયમોનો પરિચય ફક્ત ઠરાવો,
- હુકમો અને પરિપત્રો
- મ્યુ. રૂલ્સ પાર્ટ-૧ અને પાર્ટ-૨
- જનરલ બોર્ડ, સ્થાયી સમિતિના ઠરાવો
- કમિશનરશ્રી તરફથી વખતોવખત બહાર પાડવામાં આવતા પરિપત્રો, નોંધ વિ.
- ગુજરાત સરકાર તરફથી વખતોવખત બહાર પાડવામાં આવતા હુકમો, ઠરાવો (જી.આર.) વિગેરે.

મુદ્દા નં.૪(૧)(ખ)(૬) : પોતાની પાસે અથવા નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક :-

અ. ન	A કાયમી રાખવા	B ૩૫ વર્ષ રાખવા જોગ	C ૧૦ વર્ષ રાખવા જોગ	D ૫ વર્ષ રાખવા જોગ	E ૨ વર્ષ અથવા ઓડીટ થયેલ (જે પહેલું હોય તે)
૧	સરકારશ્રીના ઠરાવો, સરકારશ્રીના રૂલ્સ-રેગ્યુલેશન્સ, સ્ટેન્ડીંગ ઓર્ડર્સ, કાયદો, નિયમો, વિનિયમો અને સ્થાયી આદેશોને લગતા સરકારી ઠરાવો, ઓર્ડર્સ, પરિપત્રો અને મ્યુ. ઈલેક્શનને લગતી સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવેલ સુચનાઓ	મ્યુ.કર્મચારીઓની સર્વિસ બુક	બીલની ચૂકવણી કર્યા અંગેનું રજીસ્ટર	હયાત ન હોય તેવા પેન્શનરોની PPO ફાઈલ	જોબવર્ક, સર્વિસને લગતા, વાર્ષિક કોન્ટ્રાક્ટને લગતા પેપર્સ
૨	કલેક્ટર, મ્યુનિસિપલ ઓથોરીઝ, એલ.એફ. એકાઉન્ટના એકઝામીનર અને Remembrancer of Legal Affairs તરફથી ઈસ્યુ કરવામાં આવેલ અગત્યના વહીવટી પરિપત્રો, કાયમી પ્રકારના સ્થાયી આદેશો (ફાઈલીંગ કરતી વખતે બિનજરૂરી પેપર્સ કાઢી નાંખવા)	શિક્ષા કર્યા અંગેનાં હુકમો	પગાર અંગેના બીલો તથા એકવીટન્સ રોલ	ઈન્ડેન્ટસ બુક	ખરીદી, વેચાણ, ટેન્ટર તેમજ સુધરાઈ સમાચાર, ડાયરી, વાર્ષિક વહીવટી અહેવાલ, પ્રિન્ટેડ રેકોર્ડ્સ, એકાઉન્ટ્સ, બજેટ, રૂલ્સ અને બાયલોઝ બુક્સને લગતા કાગળો
૩	જે તે પગારધોરણમાં નવી જગ્યાઓ ઉપસ્થિત કર્યા બાબતની તેમજ જગ્યાની મુદ્દત લંબાવવા બાબતની અને રદ્દ કરાયેલ જગ્યાઓ અંગેની ફાઈલો	હયાત પેન્શનરોની PPO ફાઈલ	ગેરહાજરી બાબતનું પત્રક	બીલ રજીસ્ટર્સ	મેગેઝીન, સામાયિકો, ગવર્નમેન્ટ ગેઝેટ તથા સબસ્ક્રીપ્શન તથા લાયબ્રેરી બુક્સની ખરીદીને લગતા પેપર્સ
૪	મ્યુ.સ્ટાફને ચુકવવામાં આવતા તમામ પ્રકારની પ્રથાઓના દર જેવા કે, મોંઘવારી	નવા પ્લાન્ટ અને મશીનરીઓ કે જેની	જ્યારે કિંમત રૂ.૧૦,૦૦૦/- થી વધુ હોય પરંતુ	સ્ટોક રજીસ્ટર	ટેલીફોન રજીસ્ટર-ચાલુ રજીસ્ટર ભરાઈ જાય ત્યાં સુધી

અ. ન	A કાયમી રાખવા	B ૩૫ વર્ષ રાખવા જોગ	C ૧૦ વર્ષ રાખવા જોગ	D ૫ વર્ષ રાખવા જોગ	E ૨ વર્ષ અથવા ઓડીટ થયેલ (જે પહેલુ હોય તે)
	ભથ્થુ, ઘરભાડા ભથ્થુ વિગેરે. જેમાં કેટલીક કાયમી શિડયુલ જગ્યાઓ સાથે જોડાયેલ સ્પે.એલાઉન્સનો સમાવેશ થાય છે તેનું રજીસ્ટર તથા ફાઈલો.	કિંમત રૂ.૫૦,૦૦૦/-કે તેથી વધુ હોય તેની ખરીદી-ઈન્સ્ટોલેશનને લગતા પેપર્સ	રૂ.૫૦,૦૦૦/- થી વધતી ન હોય તેવા નવા પ્લાન્ટ, મશીનરી, સાધનોની ખરીદી, ઈન્સ્ટોલેશનને લગતા પેપર્સ-સ્ટોર્સ		
૫	B C D કેટેગરીનાં નાશ કરવા જોગ કાગળોની મંજૂરી તથા તેનું લીસ્ટ	મ્યુ.કર્મચારી સર્વિસમાં હોય ત્યાં સુધી-તેઓના સિક્યુરીટી બોન્ડસ	વર્ષ દરમ્યાન માત્ર એકાઉન્ટસ ડીપાર્ટમેન્ટના ચુકવણી અંગેના બીલોનું રજીસ્ટર, તે સિવાયના ડીપાર્ટમેન્ટના 'ડી' રેકર્ડસ	ઈનવર્ડ - આઉટવર્ડ રજીસ્ટર	ઓડીટર ધ્વારા જરૂરી ન હોય તેવા તથા અગત્યના ન હોય તેવા તમામ પેપર્સ
૬	એક્ટ, રૂલ્સ અને બાયલોઝ અને ટેક્ષ અને એસ્ટાબ્લીશમેન્ટ શીડયુલ-દરખાસ્ત અને મંજૂરીના પેપર્સ	ચોક્કસ કર્મચારીને આપવામાં આવતા પર્સનલ એલાઉન્સને લગતા કરન્ટ પેપર્સ	બીલ ફોર્મ્સ-પેમેન્ટ વાઉચર્સ ફાઈલ્સ	શિડયુલ પોસ્ટ, નિમણૂક, પોસ્ટીંગ, ટ્રાન્સફર, બઢતી ઓર્ડર, રજાના પેપર્સ, એફીશીયન્સી બાર કોસીંગની મંજૂરીના પેપર્સ, બહારના કામનું મહેનતાણું, માનદ વેતન મેળવવા અંગેના પેપર્સ, સ્વીકારેલ અન્ય ખાતાની ફરજ, ડેપ્યુટેશન સ્પે. ટ્રેનીંગ, ડેપ્યુટેશન ગ્રાંટની મંજૂરીના પેપર્સ, ડીસમીસ, અયોગ્યતા, વચનિવૃત્ત, છુટા થયા બાબતનાં, નીચલી પાયરી	ડેઈલી ડીસ્પેચ બુક્સ

અ. ન	A કાયમી રાખવા	B ૩૫ વર્ષ રાખવા જોગ	C ૧૦ વર્ષ રાખવા જોગ	D ૫ વર્ષ રાખવા જોગ	E ૨ વર્ષ અથવા ઓડીટ થયેલ (જે પહેલુ હોય તે)
				ઉપર ઉતારી મુકવા બાબતનાં, ચેતવણી અને દંડ કર્યા બાબતનાં તેમજ ખાતાકીય તપાસનાં પેપર્સ	
૭	લાયબ્રેરી રજીસ્ટર : કરન્ટ રેકર્ડ્સ જ્યાં સુધી ફરીથી ન લખાય ત્યાં સુધી અને ત્યારબાદ 'ડી' રેકર્ડ્સ મુજબ	પેન્શન પગારના ઓર્ડર્સ, કરન્ટ ઓર્ડર્સ	કાયમી તેમજ હંગામી એસ્ટાબ્લીશમેન્ટના પગાર બીલો અને એકવેઈટ્સ રોલ	પેન્શન ગ્રેજ્યુઈટીની સંમતિ આપતા પેપર્સ	કોર્પોરેશનની નોકરીમાંથી રાજીનામા અંગેના પેપર્સ
૮	મીનીટ્સ બુક	જાહેર માહિતી અધિકારીના નિર્ણય સામે પ્રથમ અપીલ/ બીજી અપીલ અને તે અન્વયે માહિતી આયોગના ચુકાદા સામે વડી અદાલતમાં રીટ પીટીશન થઈ હોય તો તેવી જાહેર માહિતી અધિકારીની ફાઈલ	આર.ટી.આઈ. એક્ટ હેઠળની અરજી પરત્વે જાહેર માહિતી અધિકારીએ આપેલ/અંશતઃ આપેલ/નહી આપેલ માહિતીની ફાઈલો (જેના ઉપર રાજ્ય માહિતી આયોગમાં બીજી અપીલ થઈ હોય અને માહિતી આયોગના આદેશો મુજબની કાર્યવાહી સંપૂર્ણ થઈ ગયેલ હોય તેવી ફાઈલો)	હંગામી અને કામચલાઉ કર્મચારીઓનાં પેપર્સ	કેઝ્યુઅલ લીવ અને સ્ટેચ્યુટરી લીવ અંગેના રીપોર્ટ્સ
૯	ચીફ ઓફિસરશ્રીના વહીવટી અહેવાલની પ્રિન્ટેડ કોપી	એપેલેટ ઓથોરીટીના પ્રથમ અપીલ પરત્વેના નિર્ણય સામે બીજી અપીલ અને તે અન્વયે માહિતી આયોગના	અરજદારે એપેલેટ ઓથોરીટીને કરેલ પ્રથમ અપીલ અંગેની ફાઈલો (જેની સામે ગુજરાત માહિતી આયોગમાં બીજી અપીલ થઈ હોય અને આયોગના	ખાતાકીય પરીક્ષા : મંજૂરી, દેખાવ (પરફોર્મન્સ), પ્રશ્નપત્ર, પ્રોગ્રામ્સ, ઉત્તરવહી, જાહેર કરેલ પરિણામ, હાજર થવાની	એમ્પ્લોયમેન્ટ માટેની અરજીઓ

અ. ન	A કાયમી રાખવા	B ૩૫ વર્ષ રાખવા જોગ	C ૧૦ વર્ષ રાખવા જોગ	D ૫ વર્ષ રાખવા જોગ	E ૨ વર્ષ અથવા ઓડીટ થયેલ (જે પહેલુ હોય તે)
		ચુકાદા સામે વડી અદાલતમાં રીટ પીટીશન થઈ હોય તો તેવી એપેલેટ ઓથોરીટીની પ્રથમ અપીલની ફાઈલ	ચુકાદા મુજબની કાર્યવાહી પુર્ણ થઈ ગયેલ હોય)	પરવાનગીના પેપર્સ	
૧૦	ગવર્નમેન્ટ ગેઝેટ	જે તે વર્ષ માટેના પ્રો-એક્ટીવ ડીસ્કલોઝરની ફાઈલ	જાહેર માહિતી અધિકારીએ નિભાવવાના રજીસ્ટર્સ, એપેલેટ ઓથોરીટીએ નિભાવવાના રજીસ્ટર્સ	પગાર ફિક્ષેશન તેમજ ગણતરી બાબતે થયેલ આઈ.ટી. એવોર્ડ મુજબ સ્ટાફ યુનિયન સાથે થયેલ કરાર બાબતના પેપર્સ	મસ્ટર રોલ અને કાયમી કર્મચારીઓની ટાઈમ બુક
૧૧	નવી જગ્યા ઉપસ્થિત કરવાના અથવા શિડયુલ પોસ્ટના પે-સ્કેલ રીવીઝન અંગેના પેપર્સ (ટેમ્પરરી જગ્યાના પેપર્સનો સમાવેશ થતો નથી.)		ત્રિમાસિક માહિતીની ફાઈલો	હાલનાં પગારધોરણ અને સીનિયોરીટી મુજબ તૈયાર કરેલ કર્મચારીઓનું લીસ્ટ	સદસ્યશ્રીઓના હાજરી પત્રકો
૧૨	સુધરાઈ સમાચારના વાર્ષિક પ્રિન્ટેડ રેકર્ડની દસ કોપી, વહીવટી અહેવાલ, વાર્ષિક હિસાબ અને જનરલ બોર્ડ પ્રોસિડીંગ્સ (પ્રિન્ટેડ) પકકા બાઉન્ડ વોલ્યુમ્સ		આર.ટી.આઈ. કાયદા નીચે મદદનીશ જાહેર માહિતી અધિકારી/ જાહેર માહિતી અધિકારી / એપેલેટ ઓથોરીટી તરીકે નિમણુંક કરવા અંગેની ફાઈલ	કર્મચારીઓ પાસેની વસુલાત બાબત : પુરેપુરી થયેલ વસુલાત અંગેની સેવાપોથીમાં નોંધ કરવા બાબત.	ઉમેદવારોનું વેઈટીંગ લીસ્ટ

અ. ન	A કાયમી રાખવા	B ૩૫ વર્ષ રાખવા જોગ	C ૧૦ વર્ષ રાખવા જોગ	D ૫ વર્ષ રાખવા જોગ	E ૨ વર્ષ અથવા ઓડીટ થયેલ (જે પહેલુ હોય તે)
૧૩	પ્રિન્ટેડ બજેટની બે નકલ			વિશિષ્ટ કામગીરી બદલ આપવામાં આવેલ પ્રશંસાપત્ર કે ભેટ બાબતેની નોંધ સેવાપોથીમાં કરવા બાબતનાં પેપર્સ.	બજેટ, વહીવટી અહેવાલ તથા તેને લગતા અન્ય રીપોર્ટસ
૧૪	ડેડ સ્ટોક રજીસ્ટર			મ્યુનિ.એક્ટ, નિયમ, વિનિયમમાં થયેલ ગુના બાબતેની ફરીયાદને લાગત પત્રવ્યવહાર	સામાન્ય સભા અને સમિતિઓના એજન્ડા તથા તેની પહોંચ
૧૫				સ્ટોર્સની રીસીપ્ટ-ઈશ્યુનું જનરલ રજીસ્ટર	પેટા ઈલેક્શન ન થયેલ હોય ત્યારે સભ્યનું રાજીનામું
૧૬				મુવેબલ પ્રોપર્ટીસનું રજીસ્ટર	સામાન્ય સભામાં મ્યુ.સભ્યશ્રીઓ ધ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નો તથા તેના જવાબો.
૧૭				પરચૂરણ પત્રવ્યવહાર	કાર્યી પ્રોસીડીંગ બુક
૧૮				ઈનવર્ડ - આઉટવર્ડ રજીસ્ટર	
૧૯				બજેટના અંદાજો	
૨૦				'એ' અને 'બી' ના લીસ્ટમાં સમાવેશ થયેલ હોય તે સિવાયના સ્કુલ બોર્ડને લગતા પેપર્સ	

અ. ન	A કાયમી રાખવા	B ૩૫ વર્ષ રાખવા જોગ	C ૧૦ વર્ષ રાખવા જોગ	D ૫ વર્ષ રાખવા જોગ	E ૨ વર્ષ અથવા ઓડીટ થયેલ (જે પહેલુ હોય તે)
૨૧				કોર્પોરેશન અને સ્કુલ બોર્ડ તથા યુનિવર્સિટીના સેનેટ સભ્યની ચૂંટણી અને પેટા-ચૂંટણીને લગતા પેપર્સ	
૨૨				આર.ટી.આઈ. એક્ટ હેઠળની અરજી પરત્વે જાહેર માહિતી અધિકારીએ આપેલ/અંશતઃ આપેલ/નહી આપેલ માહિતીની ફાઈલો (જેના ઉપર પ્રથમ અપીલ ન થઈ હોય તેવી ફાઈલો)	
૨૩				આર.ટી.આઈ. એક્ટ હેઠળની અરજી પરત્વે જાહેર માહિતી અધિકારીએ આપેલ/અંશતઃ આપેલ/નહી આપેલ માહિતીની ફાઈલો (જેના ઉપર એપેલેટ ઓથોરીટી સમક્ષ પ્રથમ અપીલ થઈ હોય પરંતુ રાજ્ય માહિતી આયોગ સમક્ષ બીજી અપીલ ન થઈ હોય તેવી ફાઈલો)	

અ. ન	A કાયમી રાખવા	B ૩૫ વર્ષ રાખવા જોગ	C ૧૦ વર્ષ રાખવા જોગ	D ૫ વર્ષ રાખવા જોગ	E ૨ વર્ષ અથવા ઓડીટ થયેલ (જે પહેલુ હોય તે)
૨૪				જાહેર માહિતી અધિકારીશ્રીના નિર્ણય સામે અરજદારે એપેલેટ ઓથોરીટીને કરેલ પ્રથમ અપીલ અંગેની ફાઈલ (જેની સામે ગુજરાત માહિતી આયોગમાં બીજી અપીલ થઈ ન હોય તેવી ફાઈલો)	

મુદ્દા નં.૪(૧)(ખ)(૭) : નીતિના ઘડતરના અથવા તેના અમલીકરણના સબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર વિનિયમ માટે અથવા તેમના ધ્વારા રજૂઆત માટેની વિદ્યમાન કોઈ વ્યવસ્થાની વિગતો :-

લાગુ પડતું નથી.

મુદ્દા નં. ૪(૧)(ખ)(૮) : તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સિલર, સમિતિઓ અને બીજા મંડળોનું પત્રક અને તે બોર્ડ, કાઉન્સિલરો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ? અથવા તેવી બેઠકોની કાર્યોનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ?

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મહિનામાં એકવાર મળશે અને જાહેર જનતા સામાન્ય સભાની કાર્યવાહી મ્યુ.કાઉન્સિલર અને મ્યુ.સેક્રેટરીને લેખિતમાં જાણ કરી, ફોર્મ ભરી પ્રેક્ષક ગેલેરીમાં બેસીને જોઈ શકશે. સ્થાયી સમિતિ અને ખાસ/તદર્થ સમિતિઓ નિયમિત રીતે સમયાંતરે મળશે. જેમાં જાહેર જનતા ભાગ લઈ શકશે નહીં. આ સમિતિઓની બધી કાર્યવાહીઓ/નોંધ જાહેર જનતા નિયત કરેલ ફી ભરીને સુરત મહાનગરપાલિકામાંથી મેળવી શકશે.

• મ્યુ.સભ્યશ્રીઓની માહિતી :-

http://www.suratmunicipal.gov.in/Corporation/Corp_list

• સમિતિઓની માહિતી :-

<http://www.suratmunicipal.gov.in/Corporation/Committees>

મુદ્દા નં.૪(૧)(ખ)(૯) : તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા.

અ. નં.	કર્મચારીનું નામ / કર્મચારી નંબર	હોદ્દો	સરનામું
૧	શ્રી શરદચંદ્ર આર. પટેલ કર્મ.નં.૧૧૩૭૮	ડેપ્યુટી સેક્રેટરી	સેક્રેટરી ઓફિસ, ચોથો માળ, નવી એનેક્ષી બિલ્ડિંગ, સુરત મહાનગરપાલિકા, મુગલીસરા, સુરત-૩૯૫૦૦૩.
૨	શ્રી નીતિનચંદ્ર પી. સોનજી કર્મ.નં.૧૩૭૮૮	ડેપ્યુટી સેક્રેટરી	—"
૩	શ્રી જતીનકુમાર કે. ઠાકર કર્મ.નં.૩૪૩૫૬	ડેપ્યુટી સેક્રેટરી	—"
૪	શ્રી રાજવીરસિંહ એમ. ખેર કર્મ.નં.૩૯૯૨૩	આસીસ્ટન્ટ સેક્રેટરી	—"

અ. નં.	કર્મચારીનું નામ / કર્મચારી નંબર	હોદ્દો	સરનામું
૫	શ્રી મિલિન્દ્રકુમાર એચ. પટેલ કર્મ.નં.૩૯૯૨૪	પ્રથમ શ્રેણી કલાર્ક	સેક્રેટરી ઓફિસ, ચોથો માળ, નવી એનેક્ષી બિલ્ડીંગ, સુરત મહાનગરપાલિકા, મુગલીસરા, સુરત-૩૯૫૦૦૩. -"-
૬	શ્રી મુકેશ આર. જરીવાલા કર્મ.નં.૩૯૯૨૫	પ્રથમ શ્રેણી કલાર્ક	-"-
૭	શ્રીમતી મનીષા બી. પટેલ કર્મ.નં.૩૯૯૨૭	પ્રથમ શ્રેણી કલાર્ક	-"-
૮	શ્રી રીગનકુમાર બી. પટેલ કર્મ.નં.૩૯૯૨૬	સ્ટેનોગ્રેડ-II	-"-
૯	શ્રી પરેશકુમાર એન. રાઠોડ કર્મ.નં.૩૯૯૨૮	સ્ટેનોગ્રેડ-II	-"-
૧૦	શ્રીમતી ઉર્વશીબેન ડી. ઠાકોર કર્મ.નં.૩૯૯૩૦	બીજી શ્રેણી કલાર્ક	-"-
૧૧	શ્રીમતી હેતલ ડી. ઉપાધ્યાય કર્મ.નં.૩૯૦૫૧	બીજી શ્રેણી કલાર્ક	-"-
૧૨	કુ.અનાહિતા એચ.પટેલ કર્મ.નં.૪૬૦૨૮	બીજી શ્રેણી કલાર્ક	-"-
૧૩	શ્રી હિમાંશુ ડી. પટેલ કર્મ.નં.૪૮૨૩૭	બીજી શ્રેણી કલાર્ક	-"-
૧૪	શ્રી ગોપાલ બી. દિયોરા કર્મ.નં.૪૮૨૩૮	બીજી શ્રેણી કલાર્ક	-"-
૧૫	શ્રી અશ્વિનકુમાર કે. દેસાઈ કર્મ.નં.૩૯૯૩૧	તાલીમાર્થી સ્ટેનોગ્રેડ-III	-"-
૧૬	શ્રી અજયકુમાર સી. પરમાર કર્મ.નં.૪૮૨૩૯	ત્રીજી શ્રેણી કલાર્ક	-"-
૧૭	શ્રી પંકજકુમાર એસ. જે. વાણી કર્મ.નં.૪૮૨૪૦	ત્રીજી શ્રેણી કલાર્ક	-"-
૧૮	શ્રી ચેતના ડી. પટેલ કર્મ.નં.૪૮૨૪૨	ત્રીજી શ્રેણી કલાર્ક	-"-
૧૯	શ્રી ચિંતનભાઈ આર. પટેલ કર્મ.નં.૪૮૨૪૩	ત્રીજી શ્રેણી કલાર્ક	-"-
૨૦	શ્રી દિનેશભાઈ પી. પટેલ કર્મ.નં.૪૮૨૪૪	ત્રીજી શ્રેણી કલાર્ક	-"-
૨૧	શ્રી ચિંતનભાઈ આર. ભટ્ટ કર્મ.નં.૪૮૨૪૫	ત્રીજી શ્રેણી કલાર્ક	-"-
૨૨	શ્રી મિનેષકુમાર આર. પટેલ કર્મ.નં.૪૮૨૪૬	ત્રીજી શ્રેણી કલાર્ક	-"-
૨૩	શ્રી ચન્દ્રકાન્ત બી. પટેલ કર્મ.નં.૪૯૦૪૦	ત્રીજી શ્રેણી કલાર્ક	-"-
૨૪	શ્રી હાર્દિકકુમાર એમ. પટેલ કર્મ.નં.૪૯૦૪૧	ત્રીજી શ્રેણી કલાર્ક	-"-
૨૫	શ્રી પ્રતિકકુમાર એસ. બ્રહ્મભટ્ટ કર્મ.નં.૪૯૦૪૨	ત્રીજી શ્રેણી કલાર્ક	-"-

અ. નં.	કર્મચારીનું નામ / કર્મચારી નંબર	હોદ્દો	સરનામું
૨૬	શ્રી ચિત્રાંગકુમાર જે. પટેલ કર્મ.નં.૪૯૦૪૩	ત્રીજી શ્રેણી ક્લાર્ક	—"
૨૭	શ્રી દિલીપસિંહ જી. ઝાલા કર્મ.નં.૧૧૯૦૧	નાયક	સેક્રેટરી ઓફિસ, ચોથો માળ, નવી એનેક્ષી બિલ્ડીંગ, સુરત મહાનગરપાલિકા, મુગલીસરા, સુરત-૩૯૫૦૦૩.
૨૮	શ્રી કલ્પેશકુમાર જી. પટેલ કર્મ.નં.૪૨૬૨૪	જમાદાર	—"
૨૯	શ્રી જીગર એમ. કાંજીવાલા કર્મ.નં.૪૨૬૨૩	જમાદાર	—"
૩૦	શ્રી જીગ્નેશ બી. સુમરા કર્મ.નં.૪૨૬૨૨	જમાદાર	—"
૩૧	શ્રી કિશોર એચ. અણજારા કર્મ.નં.૪૨૬૨૧	જમાદાર	—"
૩૨	શ્રી સ્વેતાંગ બી. પટેલ કર્મ.નં.૪૨૭૧૫	પટાવાળા	—"
૩૩	શ્રી અજયકુમાર એલ. પટેલ કર્મ.નં.૪૨૭૧૬	પટાવાળા	—"
૩૪	શ્રી વિજય એન. પરમાર કર્મ.નં.૪૨૭૧૪	પટાવાળા	—"
૩૫	શ્રી અનિલ કે. સોલંકી કર્મ.નં.૪૨૭૧૭	પટાવાળા	—"
૩૬	શ્રી કૌશિકકુમાર આર. મકવાણા કર્મ.નં.૪૨૭૧૮	પટાવાળા	—"
૩૭	શ્રી મનીષકુમાર જી. ચૌહાણ કર્મ.નં.૪૨૭૪૪	પટાવાળા	—"
૩૮	શ્રી અંકુર એન. ચપટવાલા કર્મ.નં.૪૩૩૦૦	પટાવાળા	—"
૩૯	શ્રી જીગર ડી. ઉમરીગર કર્મ.નં.૪૫૭૪૬	પટાવાળા	—"
૪૦	શ્રી ધીરજ પી. પરમાર કર્મ.નં.૪૬૦૧૦	પટાવાળા	—"
૪૧	શ્રી સ્મિત વી. ગોસાઈ કર્મ.નં.૪૮૨૭૬	પટાવાળા	—"
૪૨	શ્રી નીલેશ એમ. સોલંકી કર્મ.નં.૪૮૨૭૭	પટાવાળા	—"
૪૩	શ્રી આકાશ કે. પટેલ કર્મ.નં.૪૮૮૧૩	પટાવાળા	—"
૪૪	શ્રી હેમંતકુમાર આર. સોસા કર્મ.નં.૪૮૮૧૪	પટાવાળા	—"
૪૫	શ્રી અંકિતભાઈ એમ. પટેલ કર્મ.નં.૪૮૮૧૨	પટાવાળા	—"
૪૬	શ્રી નિશિતકુમાર એચ. પટેલ કર્મ.નં.૬૩૦૦૬	પટાવાળા	—"
૪૭	શ્રી રાજવીર બી. સોલંકી કર્મ.નં.૭૫૦૬૫	તાલીમાર્થી પટાવાળા	—"
૪૮	શ્રી ધ્રુવી જે. જરીવાલા કર્મ.નં.૭૫૪૭૦	તાલીમાર્થી પટાવાળા	—"

મુદ્દા નં.૪(૧) (ખ)(૧૦) : દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક મહેનતાણા :—

અ. નં.	કર્મચારીનું નામ / કર્મચારી નંબર	હોદ્દો	પગારધોરણ
૧	શ્રી શરદચંદ્ર આર. પટેલ કર્મ.નં.૧૧૩૭૮	ડેપ્યુટી સેક્રેટરી	પગારધોરણ : ૮૦૦૦-૧૩૫૦૦ પે બેન્ડ : ૧૫૬૦૦-૩૯૧૦૦ ગ્રેડ-પે : ૫૪૦૦ પે મેટ્રીક્ષ : ૫૬૧૦૦-૧૭૭૫૦૦
૨	શ્રી નીતિનચંદ્ર પી. સોનજી કર્મ.નં.૧૩૭૮૮	ડેપ્યુટી સેક્રેટરી	—"
૩	શ્રી જતીનકુમાર કે. ઠાકર કર્મ.નં.૩૪૩૫૬	ડેપ્યુટી સેક્રેટરી	—"
૪	શ્રી રાજવીરસિંહ એમ. ખેર કર્મ.નં.૩૯૯૨૩	આસીસ્ટન્ટ સેક્રેટરી	પગારધોરણ : ૬૫૦૦-૧૦૫૦૦ પે બેન્ડ : ૯૩૦૦-૩૪૮૦૦ ગ્રેડ-પે : ૪૬૦૦ પે મેટ્રીક્ષ : ૪૪૯૦૦-૧૪૨૪૦૦
૫	શ્રી મિલિન્દકુમાર એચ. પટેલ કર્મ.નં.૩૯૯૨૪	પ્રથમ શ્રેણી ક્લાર્ક	પગારધોરણ : ૫૫૦૦-૯૦૦૦ પે બેન્ડ : ૯૩૦૦-૩૪૮૦૦ ગ્રેડ-પે : ૪૪૦૦ પે મેટ્રીક્ષ : ૩૯૯૦૦-૧૨૬૬૦૦
૬	શ્રી મુકેશ આર. જરીવાલા કર્મ.નં.૩૯૯૨૫	પ્રથમ શ્રેણી ક્લાર્ક	—"
૭	શ્રીમતી મનીષા બી. પટેલ કર્મ.નં.૩૯૯૨૭	પ્રથમ શ્રેણી ક્લાર્ક	—"
૮	શ્રી રીગનકુમાર બી. પટેલ કર્મ.નં.૩૯૯૨૬	સ્ટેનોગ્રેડ-II	—"
૯	શ્રી પરેશકુમાર એન. રાઠોડ કર્મ.નં.૩૯૯૨૮	સ્ટેનોગ્રેડ-II	—"
૧૦	શ્રીમતી ઉર્વશીબેન ડી. ઠાકોર કર્મ.નં.૩૯૯૩૦	બીજી શ્રેણી ક્લાર્ક	પગારધોરણ : ૫૦૦૦-૮૦૦૦ પે બેન્ડ : ૯૩૦૦-૩૪૮૦૦ ગ્રેડ-પે : ૪૨૦૦ પે મેટ્રીક્ષ : ૩૫૪૦૦-૧૧૨૪૦૦
૧૧	શ્રીમતી હેતલ ડી. ઉપાધ્યાય કર્મ.નં.૩૯૦૫૧	બીજી શ્રેણી ક્લાર્ક	—"
૧૨	કુ.અનાહિતા એચ.પટેલ કર્મ.નં.૪૬૦૨૮	બીજી શ્રેણી ક્લાર્ક	—"
૧૩	શ્રી હિમાંશુ ડી. પટેલ કર્મ.નં.૪૮૨૩૭	બીજી શ્રેણી ક્લાર્ક	—"
૧૪	શ્રી ગોપાલ બી. દિયોરા કર્મ.નં.૪૮૨૩૮	બીજી શ્રેણી ક્લાર્ક	—"
૧૫	શ્રી અશ્વિનકુમાર કે. દેસાઈ કર્મ.નં.૩૯૯૩૧	તાલીમાર્થી સ્ટેનોગ્રેડ-III	પગારધોરણ : ૩૦૫૦-૪૫૯૦ પે બેન્ડ : ૫૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ-પે : ૧૯૦૦ પે મેટ્રીક્ષ : ૧૯૯૦૦-૬૩૨૦૦

અ. નં.	કર્મચારીનું નામ / કર્મચારી નંબર	હોદ્દો	પગારધોરણ
૧૬	શ્રી અજયકુમાર સી. પરમાર કર્મ.નં.૪૮૨૩૯	ત્રીજી શ્રેણી કલાર્ક	પગારધોરણ : ૩૦૫૦-૪૫૯૦ પે બેન્ડ : ૫૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ-પે : ૧૯૦૦ પે મેટ્રીક્ષ : ૧૯૯૦૦-૬૩૨૦૦
૧૭	શ્રી પંકજકુમાર એસ. જે. વાણી કર્મ.નં.૪૮૨૪૦	ત્રીજી શ્રેણી કલાર્ક	—"
૧૮	શ્રી ચેતના એસ. પટેલ કર્મ.નં.૪૮૨૪૨	ત્રીજી શ્રેણી કલાર્ક	—"
૧૯	શ્રી ચિંતનભાઈ આર. પટેલ કર્મ.નં.૪૮૨૪૩	ત્રીજી શ્રેણી કલાર્ક	—"
૨૦	શ્રી દિનેશભાઈ પી. પટેલ કર્મ.નં.૪૮૨૪૪	ત્રીજી શ્રેણી કલાર્ક	—"
૨૧	શ્રી ચિંતનભાઈ આર. ભટ્ટ કર્મ.નં.૪૮૨૪૫	ત્રીજી શ્રેણી કલાર્ક	—"
૨૨	શ્રી મિનેષકુમાર આર. પટેલ કર્મ.નં.૪૮૨૪૬	ત્રીજી શ્રેણી કલાર્ક	—"
૨૩	શ્રી ચન્દ્રકાન્ત બી. પટેલ કર્મ.નં.૪૯૦૪૦	ત્રીજી શ્રેણી કલાર્ક	—"
૨૪	શ્રી હાર્દિકકુમાર એમ. પટેલ કર્મ.નં.૪૯૦૪૧	ત્રીજી શ્રેણી કલાર્ક	—"
૨૫	શ્રી પ્રતિકકુમાર એસ. બ્રહ્મભટ્ટ કર્મ.નં.૪૯૦૪૨	ત્રીજી શ્રેણી કલાર્ક	—"
૨૬	શ્રી ચિત્રાંગકુમાર જે. પટેલ કર્મ.નં.૪૯૦૪૩	ત્રીજી શ્રેણી કલાર્ક	—"
૨૭	શ્રી દિલીપસિંહ જી. ઝાલા કર્મ.નં.૧૧૯૦૧	નાયક	પગારધોરણ : ૪૦૦૦-૬૦૦૦ પે બેન્ડ : ૫૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ-પે : ૨૪૦૦ પે મેટ્રીક્ષ : ૨૫૫૦૦-૮૧૧૦૦
૨૮	શ્રી કલ્પેશકુમાર જી. પટેલ કર્મ.નં.૪૨૬૨૪	જમાદાર	પગારધોરણ : ૩૦૫૦-૪૫૯૦ પે બેન્ડ : ૫૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ-પે : ૧૯૦૦ પે મેટ્રીક્ષ : ૧૯૯૦૦-૬૩૨૦૦
૨૯	શ્રી જીગર એમ. કાંજીવાલા કર્મ.નં.૪૨૬૨૩	જમાદાર	—"
૩૦	શ્રી જીગ્નેશ બી. સુમરા કર્મ.નં.૪૨૬૨૨	જમાદાર	—"
૩૧	શ્રી કિશોર એચ. અણજારા કર્મ.નં.૪૨૬૨૧	જમાદાર	—"
૩૨	શ્રી સ્વેતાંગ બી. પટેલ કર્મ.નં.૪૨૭૧૫	પટાવાળા	પગારધોરણ : ૨૬૫૦-૪૦૦૦ પે બેન્ડ : ૪૪૦૦-૭૪૪૦ ગ્રેડ-પે : ૧૬૫૦ પે મેટ્રીક્ષ : ૧૫૭૦૦-૫૦૦૦૦
૩૩	શ્રી અજયકુમાર એલ. પટેલ કર્મ.નં.૪૨૭૧૬	પટાવાળા	—"
૩૪	શ્રી વિજય એન. પરમાર કર્મ.નં.૪૨૭૧૪	પટાવાળા	—"

અ. નં.	કર્મચારીનું નામ / કર્મચારી નંબર	હોદ્દો	પગારધોરણ
૩૫	શ્રી અનિલ કે. સોલંકી કર્મ.નં.૪૨૭૧૭	પટાવાળા	પગારધોરણ : ૨૬૫૦-૪૦૦૦ પે બેન્ડ : ૪૪૦૦-૭૪૪૦ ગ્રેડ-પે : ૧૬૫૦ પે મેટ્રીક્સ : ૧૫૭૦૦-૫૦૦૦૦
૩૬	શ્રી કૌશિકકુમાર આર. મકવાણા કર્મ.નં.૪૨૭૧૮	પટાવાળા	—"
૩૭	શ્રી મનીષકુમાર જી. ચૌહાણ કર્મ.નં.૪૨૭૪૪	પટાવાળા	—"
૩૮	શ્રી અંકુર એન. ચપટવાલા કર્મ.નં.૪૩૩૦૦	પટાવાળા	—"
૩૯	શ્રી જીગર ડી. ઉમરીગર કર્મ.નં.૪૫૭૪૬	પટાવાળા	—"
૪૦	શ્રી ધીરજ પી. પરમાર કર્મ.નં.૪૬૦૧૦	પટાવાળા	—"
૪૧	શ્રી સ્મિત વી. ગોસાઈ કર્મ.નં.૪૮૨૭૬	પટાવાળા	—"
૪૨	શ્રી નીલેશ એમ. સોલંકી કર્મ.નં.૪૮૨૭૭	પટાવાળા	—"
૪૩	શ્રી આકાશ કે. પટેલ કર્મ.નં.૪૮૮૧૩	પટાવાળા	—"
૪૪	શ્રી હેમંતકુમાર આર. સોસા કર્મ.નં.૪૮૮૧૪	પટાવાળા	—"
૪૫	શ્રી અંકિતભાઈ એમ. પટેલ કર્મ.નં.૪૮૮૧૨	પટાવાળા	—"
૪૬	શ્રી નિશિતકુમાર એચ. પટેલ કર્મ.નં.૬૩૦૦૬	પટાવાળા	—"
૪૭	શ્રી રાજવીર બી. સોલંકી કર્મ.નં.૭૫૦૬૫	તાલીમાર્થી પટાવાળા	ફીક્સ પે-૧૫૫૦૦
૪૮	શ્રી દ્રુવી જે. જરીવાલા કર્મ.નં.૭૫૪૭૦	તાલીમાર્થી પટાવાળા	ફીક્સ પે-૧૫૫૦૦

મુદ્દા નં.૪(૧)(ખ)(૧૧) : તમામ યોજનાઓ, સુચિત ખર્ચ, સુચવેલ નાણા પરના અહેવાલોની વિગતો દર્શાવતું અંદાજપત્ર.

સેક્રેટરી ઓફિસના થનાર સંભવિત ખર્ચ માટે કરેલ અંદાજપત્રમાં જોગવાઈની વિગત સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર <http://www.suratmunicipal.gov.in> દર્શાવેલ છે.

મુદ્દા નં.૪(૧)(ખ)(૧૨) : ફાળવેલ રકમો સહિત સબસીડી કાર્યક્રમોની અમલ બજવણીની રીત અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો :

લાગુ પડતું નથી.

મુદ્દા નં.૪(૧)(ખ)(૧૩) : છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારની વિગતો.

લાગુ પડતું નથી.

મુદ્દા નં.૪(૧)(ખ)(૧૪) : ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ માહિતીને લગતી વિગતો.

જનરલ બોર્ડ, સ્થાયી સમિતિ, ખાસ/તદર્થ સમિતિઓની કાર્યસૂચી(એજન્ડા) અને ઠરાવો, કર્મચારીઓનું વહીવટી માળખું, મ્યુ.સેક્રેટરીના કાર્યો અને ફરજો, સામાન્ય સભા, સ્થાયી સમિતિ તથા ખાસ સમિતિઓની સભા સંચાલનના નિયમો અને વિનિયમો, ખાસ સમિતિઓની સત્તા અને કાર્યો, બજેટનો સારાંશ ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

- મ્યુ.સભ્યશ્રીઓની માહિતી :-
http://www.suratmunicipal.gov.in/Corporation/Corp_list
- સમિતિઓની માહિતી :-
<http://www.suratmunicipal.gov.in/Corporation/Committees>
- મહાનગરપાલિકા અને સ્થાયી સમિતિની સભાઓની કાર્યવાહી અંગેના નિયમો - ૧૯૮૦ :-
[એનેક્ષર-૧](#) અને [એનેક્ષર-૧.૧](#)
- જુદી જુદી ખાસ સમિતિઓના સભા સંચાલનના નિયમો - ૧૯૮૦ :-
[એનેક્ષર-૨](#) અને [એનેક્ષર-૨.૧](#)
- જુદી જુદી ખાસ સમિતિઓના અધિકાર તથા કાર્ય પ્રદેશ :-
[એનેક્ષર-૩](#), [એનેક્ષર-૩.૧](#), [એનેક્ષર-૩.૨](#), [એનેક્ષર-૩.૩](#)
- જનરલ બોર્ડ, સ્થાયી સમિતિ, ખાસ/તદર્થ સમિતિઓની કાર્યસૂચી(એજન્ડા) :-
<http://www.suratmunicipal.gov.in/Information/AgendaHome>
- જનરલ બોર્ડ, સ્થાયી સમિતિ, ખાસ/તદર્થ સમિતિઓના ઠરાવો :-
<http://www.suratmunicipal.gov.in/Information/ResolutionHome>

મુદ્દા નં.૪(૧)(ખ)(૧૫) : જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તેવા ગ્રંથાલય અથવા તેના વાંચનકક્ષના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો.

જાહેર ઉપયોગ માટે અત્રેના ખાતામાં અલગથી કોઈ ગ્રંથાલય અથવા વાંચનકક્ષ નથી. પરંતુ માહિતી મેળવવા અંગે માહિતી મેળવવાના અધિનિયમ હેઠળ કરેલ અરજીઓના અનુસંધાને રૂબરૂ દફતરી તપાસણી અંગેનો સમય કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૦-૩૦ કલાક થી બપોરે ૨-૩૦ કલાક તેમજ બપોરે ૩-૦૦ કલાક થી સાંજના ૬-૧૦ કલાક સુધીનો છે.

સ્થળ :-

સેક્રેટરી ઓફિસ,
ચોથો માળ, નવી એનેક્ષી બિલ્ડીંગ,
સુરત મહાનગરપાલિકા,
મુગલીસરા, સુરત-૩૯૫૦૦૩.

મુદ્દા નં.૪(૧)(ખ)(૧૬) : જાહેર માહિતી અધિકારીઓના નામ, હોદ્દા અને અન્ય વિગતો.

સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર નજીકના ટુંકાગાળામાં ફેરફાર થયેલ હોઈ તે સિવાય મહદ્અંશે સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે અને તે પણ સમયાંતરે અદ્યતન કરવામાં આવે છે. જેની લીક નીચે મુજબ છે.

https://www.suratmunicipal.gov.in/Information/RTI/RTI_PIO_APIOs

મુદ્દા નં.૪(૧)(ખ)(૧૭) : ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી.

અરજી :-

(૧) તા.૦૧-૦૪-૨૦૨૩ થી તા.૩૧-૦૩-૨૦૨૪ રજીસ્ટર નમૂનો- ૧

અપીલ :-

(૧) તા.૦૧-૦૪-૨૦૨૩ થી તા.૩૧-૦૩-૨૦૨૪ રજીસ્ટર નમૂનો- ૨

ZHL:8Z GDEM!

DHCTIGM/IWSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTHWSEZLC9/GFSATISHKUMAR LALBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/I DHCTLD/JJFVUGL
 VZHIVMITYFTGF5Z
 YI ['SH 'JICIGL;LJUTMNXEJT]ZHL:8Z

s! f; AIWT PIO GNCMMYFSRZLb ASST SECRETARY

(Mun.Secretary)

sZf PIO H[HICZ; tTDO/'C9/'K[IT]; tTDO/G[GHD o ; ZT'dI]GI; 5; 'SMMXG

SD	VZHNEZG) GHDq; ZGD)VGI VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[IS] SDm	DRU['DRCTIGE LJUT's8SDHF	HMVZHE'VYJFT[GMSM >'EFU'Vgi GPTANL '1 SZFI ['CM 'TM'; AIWT 'HFCZ; tT'D0/G'LIJ UT'VGP'TANL 'SIFGL TEZIBs; '5)6'S[VXT0' T]:5Q'NXEJJf	D/['0L s~RF	SH NYL'GSSES Z[EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJGELKk, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES' 's PIO GF IG6T'; D[YI] E 5YDqAIHEV5L GL LJUTR'56'VCE VR\$'NXEJJf
								HMCRATM			HMDHCTLVE5[GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE VE5L KhtCFq GF	VXTo' VE5L KhtCFq GF	J; j SZJDR VEJ[GS, RHE GL ZSD s~RF R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWWEZ[GSEZH [' KhtS, Dv('s! fsS f'YE(s! fs9f4) 4! !ZS4Vgl	
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
1	RNFNG WJ 01/04/2023	05/04/2023	GF	; lqVE8IVE q_* VE RIRCP_* GTGL IGD6\$ H[HNIJE VTUT SZJDRVEJL K[VGD]NFGP! YL !* AFAT GLVZHL	; DE5PGI 20/04/2023		05/05/2023		GF	GF				v
				; lqVE8IVE q_* VE RIRCP_* GTGL IGD6\$ H[HNIJE VTUT SZJDRVEJL K[VGD]NFGP! YL !* AFAT GLVZHL			05/05/2023	13/07/2023	GF	CF	16.00 12/07/2023			16.00
2	HXJWI; C VPAHCEI 26/04/2023	26/04/2023	GF	VE RIRWZ*GL DRU[DHCTLV5JF AFATP			26/05/2023	09/05/2023	CF	GF				v
3	D\$KEE AIP58[

ZHL:8Z GDEM!

DHCTIGM/IMSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTHWSEZLC9/GFSATISHKUMAR LALBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/I DHCTLD/JJFVUGL
 VZHIVMITYFTGF5Z
 YI ['SH 'JICIGL;LJUTMNXEJT]ZHL:8Z

s! f; AIWT PIO GNCMMYPSRZLb ASST SECRETARY

(Mun.Secretary)

sZf PIO H[HICZ; tTDO/'C9/'K[T]; tTDO/G[G]D o ; ZT'dI]G; 5, 'SMMXG

SD	VZHNEZG) GEDq ZGD)VGI VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[S] SDm	DRU['DRCTIGE LJUT's8]DF	HMVZHE'VYJFT[GMSM >'EFU'Vgi G'PTANL '1 SZFI ['CM 'TM'; AIWT 'HFCZ; tT'D0/G'1J UT'VGP'TANL 'SI FGL TEZIBs; '5]6'S'VXT0' T]:5Q'NXEJJf	D/['0L s~FF	SH NYL'GSSES Z[EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJRGLEKk, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES' 's PIO GF IG6T'; D'YI [E 5YDqAIHEV5L GE LJUT#56'VCE VR\$'NXEJJf
								HMCRATM			HMDHCTLVE5[GF			
								DHCTL VPM RGL TEZIB	5Z5ZE V5L Kht'CPq GF	VXT0' V5L Kht'CPq GF	J; j SZJDR VEJ[GS, RHE[GL ZSD s~FF R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWWEZ[GSEZH ['1 KhtS, Dv('s! fsS f'YE'(s! fs9f4) 4! !ZS4Vgl	
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
	11/05/2023	11/05/2023	GF	VE RIRG#S_GL DRU[DHCTLV5JF AFATP			10/06/2023	05/06/2023	CF	GF				v
4	RãJNG WJ 18/05/2023	18/05/2023	GF	VE RIRG#) ZGL DRU[DHCTLV5JF AFATP	; D5PG[23/05/2023		17/06/2023		GF	GF				v
				VE RIRG#) ZGL DRU[DHCTLV5JF AFATP			17/06/2023	13/07/2023	GF	CF	12.00 12/07/2023			12.00 v
5	DD6 XaAIZ 19/05/2023	19/05/2023	GF	VE RIRG#S_ZGL DRU[DHCTLV5JF AFATP			18/06/2023	14/06/2023	CF	GF	32.00 14/06/2023			32.00 v
6	ZDk SPHUID													

ZHL:8Z GDEM!

DHCTIGM/IMSEZ VIWGI D C9 / ; ZT DCRUZ ; JF; NG HICZ ; tTHWSEZLC9 / GFSATISHKUMAR LALBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/I DHCTLD/JJFVUGL
 VZHIVMYYFTGF5Z
 YI ['SH 'JICIGLJUTMXXEJT]ZHL:8Z

s! f; AIWT PIO GNCMMYPSRZLb ASST SECRETARY (Mun.Secretary)
 szf PIO H[HICZ; tTDO/'C9/'K[T]; tTDO/G[G]D o ; ZT'dI]GI; 5, 'SMMXG

SD	VZHNEZG) GEDq ZGD)VGI VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[S] SDm	DRU['DRCTIGE LJUT's8]DFF	HMVZHE'VYJFT[GMSM >'EFU'Vgi G'PTANL '1 SZFI ['CM 'TM'; AIWT 'HFCZ; tT'DO/G'EIJ UT'VGP'TANL 'SIFGL TEZIBs; 5]6'S[VXT0' T]:5Q'NXEJJf	D/I '0L s~FF	SH NYL'GSSES Z[EDNT'DHA' DHCTE'VE5JFq GSEJRGLEK, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES' 's PIO GF IG6T'; D[YI] E 5YDqAIHE'V5L GE LJUT#56'VCE VR\$'NXEJJf
								HMCRATM			HMDHCTLV5[GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE V5L Kht'CPq GF	VXT0' V5L Kht'CPq GF	J;] SZJDR VEJ[GS, RHE[GL ZSD s~FF R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWWEZ[GSEZH ['1 KhtS, Dv('s! fsS f'YE(s! fs9f4) 4! ! 4S4Vgl	
s! f	szf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
	01/06/2023	01/06/2023	GF	VE RDRG5ZZGL DRU[DHCTLV5JF AFATP			01/07/2023	15/06/2023	CF	GF				v
7 ; HI IT, SZH ; CIGL	12/06/2023	12/06/2023	GF	; IqVE8IVE q' Z# VE RDRG! Z# UHZE 5M]gXII, dI GL; I5, SMMV#8 VG[VUZ TMAMA[V58GLS, Dv&) 5DR[R]8Zv(GF 8IKG -, AFATGL VZHIP	; DR5PG[15/06/2023		12/07/2023		GF	GF				v

ZHL:8Z GDEM!

DHCTIGM/IMSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTHWSEZLC9/GFSATISHKUMAR LALBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/I DHCTLD/JJFVUGL
 VZHIVMITYPTGF5Z
 YI ['SH 'JICIGLJUTMNXEJT]ZHL:8Z

s! f; AIWT PIO GNCMMYPSRZLb ASST SECRETARY (Mun.Secretary)
 szf PIO H[HICZ; tTDO/'C9/'K[IT]; tTDO/G[GHD o ; ZT'dI]GI; 5; 'SMXKG

SD	VZHNEZG) GHDq; ZGD)VGI VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[S] SDm	DRU['DRCTIGE LJUT's8SDFF	HMVZHE'VYJFT[GMSM >'EFU'Vgi GPTANL '1 SZFI ['CM 'TM'; AIWT 'HFCZ; tT'D0/G'1J UT'VGP'TANL 'SI FGL TEZIBs; 5)6'S'VXT0' T':5Q'NXEJJf	D/I '0L s-ff	SH NYL'GSSES Z[EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJGELKk, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES; 's PIO GF IG6T'; D[YI] E 5YDqAIHE'V5L GE LJUT#56'VCE VR\$'NXEJJf	
								HMCRATM			HMDHCTLVE5[GF				
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE VE5L Kht'CFq GF	VXT0' VE5L Kht'CFq GF	J; j SZJDR VEJ[GS, RHE[GL ZSD s-ff R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWWEZ[GSEZH ['1 KhtS, Dv('s! fsS f'YE(s! fs9f4) 4! !ZS4Vgl		
s! f	szf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s! _f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f	
				; IqVE8IVE q' Z# VE RIRCP! Z# UHZE 5MIGXII, dI GL; I5, SMNV/58 VG[VUZ TMAMA[V58GLS, Dv&) 5DE[R]8Zv(GF 8IKG -, AFATGL VZHIP			12/07/2023	18/06/2023	GF	CF					VZHLNOTZ[SZJDR VEJ[KP

ZHL:8Z GDEM!

DHCTIGM/IMSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTHWSEZLC9/GFSATISHKUMAR LALBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/I DHCTLD/JJFVUJL
 VZHIVMITYFTGF5Z
 YI| 'SH'JICIG|LJUTMNXEJT|ZHL:8Z

s! f; AIWT PIO GNCMMYPSRZLb ASST SECRETARY

(Mun.Secretary)

sZf PIO H[HICZ; tTDO/'C9/'K[IT]; tTDO/G[GID] o ; ZT'dI]G|; 5; 'SMMXG

SD	VZHNEZG) GEDq ZGD)VGI VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV K[S] SDm	DRU 'DRCTIGE LJUT's8SDf	HMVZHE'VYJFT[GMSM >'EFU'Vgi GPTANL '1 SZFI 'CM 'TM'; AIWT 'HFCZ; tTf'D0/G'1J UT'VGP'TANL 'SIFGL TEZIBs; 5)6'Sf'VXT0' Tf:5Q'NXEJf	D/I '0L s~ff	SH NFYLGSSSES Z EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJGKk, E TEZIB	VZHNEZDRU 'DHCTL						ZIDES; 's PIO GF IG6T'; D[YI E 5YDqAIHE'V5L GE LJUT#56'VCE VR\$'NXEJf
								HMCRATM			HMDHCTLVf5 GF			
								DHCTL VfM RGL TEZIB	5Z5ZE Vf5L Kht'CFq GF	VXT0' Vf5L Kht'CFq GF	J; SZJDR VEJ GS, RHE GL ZSD s~ff R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWWEZ[GSEZH ' KhtS, Dv('s! fsS f'YE'(s! fs9f4) 4! !ZS4Vgl	
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
1	zLDMDN; , ID . :DE , XB 02/09/2023	02/09/2023	GF	s5! &fZNX UEDT/ 5Z; LJ0 BF VEJ ZNX 8fpG dI]G; I5, VME; GLDHCTL VE5JFAFATP			02/10/2023	03/10/2023	CF	GF	2.00 30/09/2023			2.00 v
2	HITgEE 5RHEE SHK0IF 17/08/2023	17/08/2023	GF	8IP5IP.SID GPZS sDMF JZHKFpTZfDFR VQ 5LP! #_4## ! 5(AFAT	HICZ; tTfD0/G 14/09/2023		16/09/2023		GF	GF				v
3	GZKEE VGPAYJZ 28/06/2023	28/06/2023	GF	VE RIRGP* &ZGL DRU DHCTLVf5JF AFATP	HICZ; tTfD0/G 03/07/2023		28/07/2023		GF	GF				v
4	XB VaN DHIN . A CID													

ZHL:8Z GDEM!

DHCTIGM/IMSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HFCZ ; tTHWSEZLC9/GFSATISHKUMAR LALBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/I DHCTLD/JJFVUGL
 VZHIVMITYFTGF5Z
 YI| 'SH'JICIG|LJUTMNXEJT|ZHL:8Z

s! f; AIWT PIO GNCMMYPSRZLb ASST SECRETARY

(Mun.Secretary)

sZf PIO H[HICZ; tTDO/'C9/'K[TI; tTDO/G[GHD o ; ZT'dI]GI; 5, 'SMXK

SD	VZHNEZG) GEDq; ZGD)VGI VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV K S SDm	DRU 'DRCTIGL LJUT's8SDFF	HMVZHE'VYJFT[GMSM >'EFU'VGI GPTANL '1 SZEL 'CM 'TM'; AIWT 'HFCZ; tT'DO/GI'1J UT'VGP'TANL 'SI FGL TEZIBs; 5)6'S'VXT'o' T':5Q'NXEJJf	D/I 'OL' s-ff	SH NYL'GSSES Z EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJRGLEKk, E TEZIB	VZHNEZDRU 'DHCTL						ZIDES' 's PIO GF IG6I'; D[YI E 5YDqAIHE'V5L GE LJUTR'56'VCE VR\$'NXEJJf
								HMCRATM			HMDHCTLVE5 GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE VE5L Kht'CPq GF	VXTo' VE5L Kht'CPq GF	J; SZJDR VEJ GS, RHE GL ZSD s-ff R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWWEZ GSEZH '1 KhtS, Dv('s! fsS f'YE'(s! fs9f4) 4! ! ZS4Vgl	
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
	03/07/2023	03/07/2023	GF	VE RDRP* (#GL DRU DHCTLV5JF AFATP			02/08/2023	25/07/2023	CF	GF	2.00 21/07/2023			2.00 v
5	CQ'ZD6, E DML 05/07/2023	06/07/2023	GF	; IqVE8IVE q &) VE RDRP! &) UHZE' 5N0gXII, dI GL; I5, SMNM/S8 VG VUZ TMAMA AFATGLGL VZHIP	HFCZ; tT'DO/GI 10/07/2023		05/08/2023		GF	GF				v
6	XB VBDHN. AICD 21/07/2023	21/07/2023	GF	VE RDRP!_#*GL DRU DHCTLV5JF AFATP			20/08/2023	10/08/2023	CF	GF	2.00 07/08/2023			2.00 v
7	VHXQ 5D JNG ; RDLJE/F													

ZHL:8Z GDEM!

DHCTIGM/IMSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HFCZ ; tTHWSEZLC9/GFSATISHKUMAR LALBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/I DHCTLD/JJFVUGL
 VZHIVMITYFTGF5Z
 YI ['SH 'JICIGL;LJUTMNXEJT]ZHL:8Z

s! f; AIWT PIO GNCMMYPSRZLb ASST SECRETARY

(Mun.Secretary)

sZf PIO H[HICZ'; tTDO/'C9/'K[T]; tTDO/G[GID o ; ZT'dI]GL; 5, 'SMMXG

SD	VZHNEZG) GEDq; ZGD)VGL VZHIGL TEZIB	VZHLD?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[S] SDm	DRU['DRCTIGE LJUT's8SDFF	HMVZHE'VYJFT[GMSM >'EFU'VgI G'PTANL '1 SZFI ['CM 'TM'; AIWT 'HFCZ; tT'D0/G'LIJ UT'VGP'TANL, 'SI FGL TEZIBs; '5)6'S'VXT0' T':5Q'NXEJJf	D/I '0L s-ff	SH NFYLGSSSES Z[EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJGELKk, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES' 's PIO GF IG6T'; D'YI [E 5YDqAIHE'V5L GL LJUT#56'VCE VR\$'NXEJJf
								HMCRTM			HMDHCTLVE5[GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE V5L Kht'CPq GF	VXT0' V5L Kht'CPq GF	J; j SZJDR VEJ[GS, RHE[GL ZSD s-ff R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWWEZ[GSEZH ['1 KhtS, Dv('s! fsS f'YE'(s! fs9f4) 4! !ZS4Vgl	
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s! _f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
	31/07/2023	31/07/2023	GF	; lqVE8IVE q#! VE RIRG#! T] AFATGL GLVZHIP	HFCZ; tT'D0/G[07/08/2023		30/08/2023		GF	GF				v
8	IDGHAÇ VZIJNEE 5[gZ 09/08/2023	09/08/2023	GF	VE RIRG# ZS) GL DRU[DHCTLV5JF AFATP			08/09/2023	20/09/2023	CF	GF				v
9	CDIAG VZIJNEE 5[gZ 09/08/2023	09/08/2023	GF	VE RIRG# ZS) GL DRU[DHCTLV5JF AFATP			08/09/2023	20/09/2023	CF	GF				v
10	VHXQVZIJNEE 5[gZ 09/08/2023	09/08/2023	GF											

ZHL:8Z GDEM!

DHCTIGM/IMSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTHWSEZLC9/GFSATISHKUMAR LALBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/I DHCTLD/JJFVUJL
 VZHIVMYYFTGF5Z
 YI ['SH 'JICIGL;LJUTMNXEJT]ZHL:8Z

s! f; AAWT PIO GNCMMYFSRZLb ASST SECRETARY

(Mun.Secretary)

sZf PIO H[HICZ; tTBD0/C9/K[T]; tTBD0/G[GHD] o ; ZT'dI]GL; 5; 'SMMXKG

SD	VZHNEZG) GBDq ZGD)VGL VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[S] SDm	DRU['DRCTIGE LJUT's8SDFF	HMVZHE'VYJFT[GMSM >'EFU'Vgi GPTANL '1 SZEL ['CM 'TM'; AAWT 'HFCZ; tTf'D0/GELJ UT'VGP'TANL 'SIFGL TEZIBs; 5)6'Sf'VXTo' Tf:5Q'NXEJJf	D/I '0L s-ff	SH NYL'GSSES Z[EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJRGLEKk, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES; 's PIO GF IG6T'; BfYI [E 5YDqAIHEV5L GL LJUT#56'VCE VR\$'NXEJJf
								HMCRTM			HMDHCTLV5[GF			
								DHCTL VPM RGL TEZIB	5Z5ZE V5L Kht'CPq GF	VXTo' V5L Kht'CPq GF	J; j SZJDR VEJ[GS, RHE[GL ZSD s-ff R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWWEZ[GSEZH ['1 KhtS, Dv('s! fsS f'YE(s! fs9f4) 4! ! 4S4Vgl	
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
				VE RIRGP! Z5! GL DRU[DHCTLV5JF AFATP			08/09/2023	20/09/2023	CF	GF				v
11	VHXQVZLJNEE 5[g8Z 09/08/2023	09/08/2023	GF	VE RIRGP! Z5ZGL DRU[DHCTLV5JF AFATP			08/09/2023	20/09/2023	CF	GF				v
12	UM6E SGLE E , HEF 21/08/2023	21/08/2023	GF	VE RIRGP! ##! GL DRU[DHCTLV5JF AFATP	: DE5PG[11/09/2023		20/09/2023		GF	GF				v
				VE RIRGP! ##! GL DRU[DHCTLV5JF AFATP		20/09/2023	14/10/2023	GF	CF	14.00 13/09/2023			14.00	v
13	VNKK VHG; FA/[

ZHL:8Z GDEM!

DHCTIGM/IMSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTHWSEZLC9/GFSATISHKUMAR LALBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/I DHCTLD/JJFVUGL
 VZHIVMITYFTGF5Z
 YI ['SH JICIGLJUTMNXEJT]ZHL:8Z

s! f; AAWT PIO GNCMMYPSRZLb ASST SECRETARY

(Mun.Secretary)

sZf PIO H[HICZ; tTDO/'C9/'K[T]; tTDO/G[GID o ; ZT'dI]GI; 5; 'SMXK

SD	VZHNEZG) G8Dq; ZGD)VGI VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[S] SDm	DRU['DRCTIGE LJUT's8SDP	HMVZHE'VYJFT[GMSM >'EFU'VGI GPTANL '1 SZEL ['CM 'TM'; AAWT 'HFCZ; tT'DO/GI'IJ UT'VGP'TANL 'SIFGL TEZIBs; 5)6'S'VXT0' T':5Q'NXEJJf	D/I '0L s~P	SH NFYLGSES Z[EDNT'DHA' DHCTE'VE5JFq GSEJRGLEK, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES; 's PIO GF IG6T'; 8YI [E 5YDqAIHE'V5L GE LJUT#56'VCE VR\$'NXEJJf
								HMCRATM			HMDHCTLVE5[GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE VE5L Kht'CPq GF	VXT0' VE5L Kht'CPq GF	J; j SZJDR VEJ[GS, RHE[GL ZSD s~P R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWWEZ[GSEZH [' KhtS, Dv ('s! fsS f'YE ('s! fs9f4) 4! ! ZS4Vgl	
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! !f	s! Zf	s! #f	s! Sf	s! 5f
	22/08/2023	22/08/2023	GF	VE RIRGP#S (GL DRU[DHCTLV5JF AFATP			21/09/2023	08/11/2023	CF	GF				v
14	T-CFRNJE F 01/09/2023	01/09/2023	GF	VE RIRGP S SZGL DRU[DHCTLV5JF AFATP			01/10/2023	06/10/2023	CF	GF	4.00 04/10/2023			4.00 v
15	DWEE ZDEE SISIOIF 05/09/2023	05/09/2023	GF	; IqV8IVE q(S VE RIRGZ(S ; ZT DCRGUZ 5H, SFGL :Y5GFSI EZ[Y. m VG[DNFGP! YL* GLVZHIP			05/10/2023	26/10/2023	CF	GF				v
16	ZDK SPHUIO													

ZHL:8Z GDEM!

DHCTIGM/IMSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTHWSEZLC9/GFSATISHKUMAR LALBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/I DHCTLD/JJFVUJL
 VZHIVMITYFTGF5Z
 YI ['SH 'JICIGLJUTMNXEJT]ZHL:8Z

s! f; AIWT PIO GNCMMYPSRZLb ASST SECRETARY (Mun.Secretary)
 szf PIO H[HICZ; tTDO/'C9/'K[T]; tTDO/G[G]D o ; ZT'dI]GI; 5; 'SMMXG

SD	VZHNEZG) G8Dq; ZGD)VGI VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[S] SDm	DRU['DRCTIGE LJUT's8SDFF	HMVZHE'VYJFT[GMSM >'EFU'VgI G'PTANL '1 SZFI ['CM 'TM'; AIWT 'HFCZ; tT'D0/G'LIJ UT'VGP'TANL 'SI FGL TEZIBs; 5)6'S'VXT0' T! :5Q'NXEJJf	D/I '0E s~FF	SH NYL'GSSES Z[EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJGELKk, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES' 's PIO GF IG6T'; 8FYI [E 5YDqAIHIV5L GE LJUT#56'VCE VR\$'NXEJJf
								HMCRATM			HMDHCTLVE5[GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE VE5L Kht'CPq GF	VXT0' VE5L Kht'CPq GF	J; j SZJDR VEJ[GS, RHE[GL ZSD s~FF R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWWEZ[GSEZH ['1 KhtS, Dv('s! fsS f'YE(s! fs9f4) 4! ! 4S4Vgl	
s! f	szf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s! _f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
	06/09/2023	06/09/2023	GF	VE RIRGP S (#GL DRU[DHCTLVE5JF AFATP			06/10/2023	04/10/2023	CF	GF				v
17	15S, 5IP3LJE F 06/09/2023	06/09/2023	GF	; IqV8IVE q) Z VE RIRGZ) Z UHZF ; ZSE wJZF ; HDe[JCU8L IJERU4GF5Z15+ SDS 5IXDL ! _vZ __*v##5# &S VE5JFAFAT GL VZHIP			06/10/2023	01/11/2023	CF	GF				v
18	HUT g]hvZS ; ZT Hk, F aI ZNRIO DC9NEE HIPVUJE 08/09/2023	08/09/2023	GF											

ZHL:8Z GDEM!

DHCTIGM/IMSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTHWSEZLC9/GFSATISHKUMAR LALBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/I DHCTLD/JJFVUGL
 VZHIVMITYFTGF5Z
 YI ['SH'JICIGLJUTMNXEJT]ZHL:8Z

s! f; AAWT PIO GNCMMYPSRZLb ASST SECRETARY (Mun.Secretary)
 szf PIO H[HICZ; tTDO/'C9/'K[IT]; tTDO/G[GHD o ; ZT'dI]GI; 5; 'SMXK

SD	VZHNEZG) GHDq; ZGD)VGI VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[S] SDm	DRU['DRCTIGE LJUT's8]DFF	HMVZHE'VYJFT[GMSM >'EFU'Vgi GPTANL '1 SZFI ['CM 'TM'; AAWT 'HFCZ; tT'DO/GI'IJ UT'VGP'TANL 'SI FGL TEZIBs; '5]6'SP'VXT0' T]:5Q'NXEJJf	D/I '0L s-ff	SH NYL'GSSES Z[EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJRGLEK, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES; 's PIO GF IG6I'; D[YI] E 5YDqAIHEV5L GE LJUT#56'VCE VR\$'NXEJJf
								HMCRATM			HMDHCTLVE5[GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE VF5L Kht'CPq GF	VXT0' VF5L Kht'CPq GF	J; j SZJDR VEJ[GS, RHE[GL ZSD s-ff R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWZ[GSEZH ' KhtS, Dv('s! fsS f'YE'(s! fs9f4) 4! ! ZS4Vgl	
s! f	szf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s! _f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
					; IqVZ8IVE q) 5 VE RIRGZ) 5 ; ZT XCZGFJM'GP#_ GF TDD SMXKZ zLVM GD) ; Z GDF VE5JF AFAT GLVG(DNFCP ! YL) GLVZHIP		08/10/2023	06/10/2023	CF	GF	10.00 05/10/2023			10.00 v
19	ZISX CIZ5ZF 06/09/2023	14/09/2023	GF		; IqVZ8IVE q) # VE RIRGZ) # !! q) q) # DRU[DHCTLVF5]ERUG[, UTLG CM VG[VF5GLSRZIGFSH" ; F[GHSYL ; S/H[CM JW JE/LAFAT[GL VZHIP		14/10/2023	03/10/2023	CF	GF				v
20	DCXRN=VD] BEE 5ZJ0IF 25/09/2023	25/09/2023	GF											

ZHL:8Z GDEM!

DHCTIGM/IMSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTHWSEZLC9/GFSATISHKUMAR LALBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/I DHCTLD/JJFVUGL
 VZHIVMITYFTGF5Z
 YI ['SH 'JICIGL;LJUTMNXEJT]ZHL:8Z

s! f; AAWT PIO GNCMMYPSRZLb

ASST SECRETARY

(Mun.Secretary)

sZf PIO H[HICZ; tTDO/'C9/'K[T]; tTDO/G[G]D o

; ZT'dI]GI; 5; 'SMXKG

SD	VZHNEZG) G8Dq ZGD)VGI VZHIGL TEZIB	VZHLD?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[S] SDm	DRU['DRCTIGE LJUT's8SDf	HMVZHE'VYJF'T[GMSM >'EFU'Vgi G'PTANL '1 SZFI ['CM 'TM'; AAWT 'HFCZ; tT'D0/G'LIJ UT'VGP'TANL 'SIFGL TEZIBs; '5)6'S'VXT0' T':5Q'NXEJJf	D/I '0L s~ff	SH NYL'GSSES Z[EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJGELKk, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES' 's PIO GF IG6T'; 8[YI] E 5YDqAIHE'V5L GE LJUT#56'VCE VR\$'NXEJJf
								HMCRATM			HMDHCTLVE5[GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE VE5L Kht'CPq GF	VXT0' VE5L Kht'CPq GF	J; j SZJDR VEJ[GS, RHE GL ZSD s~ff R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWWEZ[GSEZH [' KhtS, Dv('s! fsS f'YE'(s! fs9f4) 4! !ZS4Vgl	
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
				VE RIRGP 5) (GL DRU[DHCTLVE5JF AATP	HICZ; tT'D0/G[03/10/2023		25/10/2023		GF	GF				VZHL; '56'TANL SZ[KP

ZHL:8Z GDEM!

DHCTIGM/IMSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTHWSEZLC9/GFSATISHKUMAR LALBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/I DHCTLD/JJFVUGL
 VZHIVMITYFTGF5Z
 YI ['SH 'JICIGLJUTMNXEJT]ZHL:8Z

s! f; AAWT PIO GNCMMYPSRZLb ASST SECRETARY (Mun.Secretary)
 szf PIO H[HICZ'; tTDO/'C9/'K[IT]; tTDO/GIGD o ; ZT'dI]GI; 5; 'SMMXG

SD	VZHNEZG) GEDq; ZGD)VGI VZHIGL TEZIB	VZHL D? I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[S] SDm	DRU['DRCTIGE LJUT's8SDf	HMVZHE'VYJFT[GMSM >'EFU'VGI G'PTANL '1 SZFI ['CM 'TM'; AAWT 'HFCZ; tT'D0/GI'IJ UT'VGP'TANL 'SI FGL TEZIBs; '5)6'S'VXT0' T! :5Q'NXEJJf	D/['0L s~ff	SH NYL'GSSES Z[EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJGELKk, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES; 's PIO GF IG6T'; D[YI] E 5YDqAIHE'V5L GE LJUTR'56'VCE VR\$'NXEJJf
								HMCRTM			HMDHCTLV5[GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE V5L Kht'CPq GF	VXT0' V5L Kht'CPq GF	J; j SZJDR VEJ[GS, RHE GL ZSD s~ff R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWWEZ[GSEZH [' KhtS, Dv('s! fsS f'YE'(s! fs9f4) 4! !ZS4Vgl	
s! f	szf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
1	5IS, 5LWJE, Fs VQJMBf 02/11/2023	02/11/2023	GF	5IS, M LJ:TEZR VEJ[8IP5IR&4 OH% M GP'Z* VG[!Z(DRYL8IP5IP OE G, YI FAN VHNG ; JMDRhm wJZF:YHL; IDIT wJZFS[8fpG % KIU wJZFYI [9ZE'ML GS, M			02/12/2023	19/12/2023	CF	GF				v
2	T-CFRNJE F 20/09/2023	20/09/2023	GF	VE RIRGP! 5*&GL DRU[DHCTLV5JF AFATP			20/10/2023	19/10/2023	CF	GF				v
3	VIEQ\$ V[BMM TYF SHTEE VRP 09/10/2023	09/10/2023	GF											

ZHL:8Z GDEM!

DHCTIGM/WSZ VIMIGI D C9 / ; ZT DCRUZ ; JF; NG HFCZ ; tTHWSEZLC9/GFSATISHKUMAR LALBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/I DHCTLD/JJFVUGL
 VZHLVMTYPTGF5Z
 YI ['SH'JICIGL;LJUTMNXEJT]ZHL:8Z

s! f; AWT PIO GNCMMYPSRZLb ASST SECRETARY (Mun.Secretary)
 szf PIO H[HICZ; tTDO/'C9/'K[IT]; tTDO/G[GID] o ; ZT'dI]GI; 5; 'SMMXG

SD	VZHNEZG) GEDq; ZGD)VGI VZHIGL TEZIB	VZHLD?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[S] SDm	DRU['DRCTIGE LJUT's8SDFF	HMVZHE'VYJFT[GMSM >'EFU'VgI GPTANL '1 SZFI ['CM 'TM'; AAWT 'HFCZ; tT'DO/GI'IJ UT'VGPTANL 'SIFGL TEZIBs; 5)6'S[VXT0' T]:5Q'NXEJJf	D/['0L s~FF	SH NYL'GSSES Z[EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJGELKk, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES; 's PIO GF IG6I'; D[YI] E 5YDqAIHE'V5L GI LJUTR'56'VCE VR'S'NXEJJf	
								HMCRTM			HMDHCTLVE5[GF				
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE VE5L Kht'CPq GF	VXT0' VE5L Kht'CPq GF	J; j SZJDR VEJ[GS, RHE[GL ZSD s~FF R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWWEZ[GSEZH [' KhtS, Dv('s! fsS f'YE(s! fs9f4) 4! !ZS4Vgl		
s! f	szf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s! _f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f	
				VE RIRCP#&Z Z_Z! YLVHING ; JWDR; ZT DCRuz5H, SIGL ; DEq; EDR HG5[IGMVMwJZF D\$JDRVEJ[5kGML; bIFDPH 5kGM/gJI[VE5[HJFAMLDHCTLVGI ZH[SZ[; D:IRGL TEZIB4GISE TEZIB SZ[; RG4ZHVF VgJI[YI]			08/11/2023	07/11/2023	CF	GF					v
4	VIEQ\$ V[P]MF TYF SHTEE VRP 13/10/2023	13/10/2023	GF												

ZHL:8Z GDEM!

DHCTIGM/IWSEZ VIWIGI D C9/ ; ZT DCKGUZ ; JF; NG HFCZ ; tTHWSEZLC9/GFSATISHKUMAR LALBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/I DHCTLD/JJFVUGL
 VZHIVMTYFTGF5Z
 YI| 'SH'JICIG|LJUTMNXEJT|ZHL:8Z

s! f; AIWT PIO GNCMMYPSRZLb ASST SECRETARY (Mun.Secretary)
 szf PIO H[HICZ; tTDO/'C9/'K[IT]; tTDO/G[GHD o ; ZT'dI]GI; 5; 'SMMXG

SD	VZHNEZG) GHDq; ZGHD)VGI VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV K[S] SDm	DRU 'DRCTIGE LJUT's8SDP	HMVZHE'VYJFT[GMSM >'EFU'Vgi G'PTANL '1 SZFI 'CM 'TM'; AIWT 'HFCZ; tT'D0/G'EIJ UT'VGP'TANL 'SIFGL TEZIBs; '5)6'S'VXTo' T :5Q'NXEJJf	D/I '0L s~P	SH NYL'GSSES Z EDNT'DHA' DHCTE'VE5JFq GSEJRGLEKk, E TEZIB	VZHNEZDRU 'DHCTL						ZIDES; 's PIO GF IG6T'; D[YI E 5YDqAIHEV5L GE LJUTR'56'VCE VR\$'NXEJJf	
								HMCRATM			HMDHCTLVE5 GF				
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE VE5L Kht'CPq GF	VXTo' VE5L Kht'CPq GF	J; SZJDR VEJ GS, RHE GL ZSD s~P R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWZ[GSEZH ' KhtS, Dv('s! fsS f'YE'(s! fs9f4) 4! ! 4S4Vgl		
s! f	szf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f	
				VE RIRGP#! HG5 TGIMVWJZF 5MIGFJMDR5DR6 S DHZ YI UG8GL ZSD TDH DHZ UG8DNLJ5ZEX SZ UG8 VG H SDDRH UG8 J5Z CM T SDGLLJUT TDH JQFVT AIG J5ZEX 50LZC UG8GLZSDGLTYF Vgl DNFGP! YL! !			12/11/2023	07/11/2023	CF	GF					v
5	DC9NEE sHUT g hf 20/10/2023	20/10/2023	GF	VE RIRGP# (5; ZT XCZ GFJM'GPZ) GF TDH SMM8ZzIGF GH; ZGHDFDMGP ; F GLJUT TYF Vgl DNFGP! YL& GLVZHL			19/11/2023	09/11/2023	CF	GF	16.00 07/11/2023			16.00	v
6	HEIN XB														

ZHL:8Z GDEM!

DHCTIGM/IWSEZ VIWIGI D C9 / ; ZT DCKGUZ ; JF; NG HFCZ ; tTHWSEZLC9/GSATISHKUMAR LALBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/I DHCTLD/JJFVUGL
 VZHIVMITYPTGF5Z
 YI ['SH 'JICIGL;LJUTMNXEJT]ZHL:8Z

s! f; AIWT PIO GNCMMYPSRZLb ASST SECRETARY

(Mun.Secretary)

sZf PIO H[HICZ; tTDO/'C9/'K[T]; tTDO/G[GHD o ; ZT'dI]GL; 5, 'SMXKG

SD	VZHNEZG} GHDq ZGD)VGL VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[S] SDm	DRU['DRCTIGE LJUT's8SDf	HMVZHE'VYJFT[GMSM >'EFU'Vgi G'PTANL '1 SZEL ['CM 'TM'; AIWT 'HFCZ; tT'D0/G'LIJ UT'VGP'TANL 'SIFGL TEZIBs; 5)6'S'VXT0' T':5Q'NXEJJf	D/['0L s~ff	SH NYL'GSSES Z[EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJGELKk, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES' 's PIO GF IG6T'; D[YI] E 5YDqAIHE'V5L GL LJUT#56'VCE VR\$'NXEJJf
								HMCRATM			HMDHCTLVE5[GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE VE5L Kht'CFq GF	VXT0' VE5L Kht'CFq GF	J; j SZJDR VEJ[GS, RHE GL ZSD s~ff R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWWEZ[GSEZH [' KhtS, Dv('s! fsS f'YE'(s! fs9f4) 4! !ZS4Vgl	
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
	30/11/2023	30/11/2023	GF	VE RIRGZ! ##GL DRU[DHCTLVE5JF AATP			30/12/2023	19/12/2023	CF	GF				v

ZHL:8Z GDEM!

DHCTIGM/IMSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HFCZ ; tTHWSEZLC9/GF MILINDKUMAR HARJIVANBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/ DHCTLD/JJFVUGL
 VZHIVMITYFTGF5Z
 YI ['SH 'JICIGL;LJUTMNXEJT]ZHL:8Z

s! f; AIWT PIO GMCMMYPSRZLb CLERK - I (Mun.Secretary)

sZf PIO H[HICZ; tTDO/'C9/'K[IT]; tTDO/G[GHD o ; ZT'dI]GI; 5; 'SMMXG

SD	VZHNEZG) GHDq ZGH)VG VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV K[S SDm	DRU 'DRCTIGE LJUT's8SDFF	HMVZHE'VYJFT[GMSM >'EFU'Vgi GPTANL '1 SZFI 'CM 'TM'; AIWT 'HFCZ; tT'DO/GI'1J UT'VGP'TANL 'SI FGL TEZIBs; 5)6'SP'VXT0' Tf:5Q'NXEJJf	D/ '0L s-ff	SH NYL'GSSES Z EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJGELKk, E TEZIB	VZHNEZDRU 'DHCTL						ZIDES; 's PIO GF IG6T'; D[YI E 5YDqAIHE'V5L GE LJUT#56'VCE VR\$'NXEJJf
								HMCRATM			HMDHCTLV5 GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE V5L Kht'CPq GF	VXT0' V5L Kht'CPq GF	J; SZJDR VEJ GS, RHE GL ZSD s-ff R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWWEZ[GSEZH ' KhtS, Dv('s! fsS f'YE(s! fs9f4) 4! ! ZS4Vgl	
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
1	IN5SEE VHCZ 04/10/2023	04/10/2023	GF	VE RIRGP (&) SGL DRU DHCTLV5JF AFATP			03/11/2023	16/12/2023	CF	GF				v
2	IRZHU UU, I6L 23/10/2023	23/10/2023	GF	VE RIRGP (S&GL DRU DHCTLV5JF AFATP	; D5PFG 04/11/2023		22/11/2023		GF	GF				v
				VE RIRGP (S&GL DRU DHCTLV5JF AFATP			22/11/2023	09/11/2023	GF	CF				v
3	EHURN 18/12/2023	18/12/2023	GF	VE RIRGP#_&GL DRU DHCTLV5JF AFATP	HICZ; tT'DO/G 28/12/2023		17/01/2024		GF	GF				v

ZHL:8Z GDEM!

DHCTIGM/IWSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTHWSEZLC9/GF MILINDKUMAR HARJIVANBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/ DHCTLD/JJFVUGL
 VZHIVMITYFTGF5Z
 YI ['SH 'JICIGL;LJUTMNXEJT]ZHL:8Z

s! f; AIWT PIO GNCMMYPSRZLb CLERK - I

(Mun.Secretary)

sZf PIO H[HICZ; tTDO/'C9/'K[T]; tTDO/G[GID o ; ZT'dI]GI; 5; 'SMMXG

SD	VZHNEZG) G8Dq ZGD)VGI VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[S] SDm	DRU['DRCTIGE LJUT's8SDP	HMVZHEVYJFT[GMSM >'EFU'Vgi GPTANL '1 SZFI ['CM 'TM'; AIWT 'HFCZ; tT'D0/GI'1J UT'VGPTANL 'SIFGL TEZIBs; 5)6'S[VXTo' T':5Q'NXEJJf	D/['0L s~P	SH NYL'GSSES Z[EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJGELKk, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES; 's PIO GF IG6T'; 8[YI] E 5YDqAIHEV5L GE LJUT#56'VCE VR\$'NXEJJf
								HMCR TM			HMDHCTLVE5[GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE VE5L Kht'CPq GF	VXTo' VE5L Kht'CPq GF	J; j SZJDR VEJ[GS, RHE GL ZSD s~P R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWWEZ[GSEZH [' KhtS, Dv ('s! fsS f'YE ('s! fs9f4) 4! !ZS4Vgl	
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
				5[V]0 5B"			17/01/2024	28/12/2023	CF	GF				v

ZHL:8Z GDEM!

DHCTIGM/IVSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTHWSEZLC9/GF MILINDKUMAR HARJIVANBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/ DHCTLD/JJFVUGL
 VZHIVMITYFTGF5Z
 YI ['SH 'JICIGL;LJUTMNXEJT]ZHL:8Z

s! f; AIWT PIO GNCMMYPSRZLb CLERK - I (Mun.Secretary)
 szf PIO H[HICZ; tTDO/'C9/'K[IT]; tTDO/G[GHD o ; ZT'dI]GI; 5; 'SMMXG

SD	VZHNEZG) GHDq ZGD)VGI VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[S] SDm	DRU['DRCTIGE LJUT's8SDFF	HMVZHE'VYJFT[GMSM >'EFU'Vgi GPTANL '1 SZFI ['CM 'TM'; AIWT 'HFCZ; tT'DO/G'LIJ UT'VGP'TANL 'SIFGL TEZIBs; 5)6'S[VXTo' T]:5Q'NXEJJf	D/['O[s~FF	SH NYL'GSSES Z[EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJGELKk, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES' 's PIO GF IG6T'; D[YI] E 5YDqAIHEV5L GL LJUT#56'VCE VR\$'NXEJJf
								HMCRATM			HMDHCTLV5[GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE V5L KhtCPq GF	VXTo' V5L KhtCPq GF	J; j SZJDR VEJ[GS, RHE GL ZSD s~FF R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWWEZ[GSEZH [' KhtS, Dv('s! fsS f'YE(s! fs9f4) 4! !ZS4Vgl	
s! f	szf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
1	ZIJ 3GxI DEE S/YIF 27/12/2023	27/12/2023	GF	VE RIRGZS! SGL DRU[DHCTLV5JF AFATP			26/01/2024	02/02/2024	CF	GF				v
2	I5S, 5D] Rã 3LJE F 01/01/2024	01/01/2024	GF	VE RIRGZS5 (GL DRU[DHCTLV5JF AFATP	; D55PGI 03/01/2024		31/01/2024		GF	GF				v
				VE RIRGZS5 (GL DRU[DHCTLV5JF AFATP			31/01/2024	03/01/2024	GF	CF				
3	I5S, 5D] Rã 3LJE F 01/01/2024	01/01/2024	GF	VE RIRGZS5) GL DRU[DHCTLV5JF AFATP	; D55PGI 03/01/2024		31/01/2024		GF	GF				v

ZHL:8Z GDEM!

DHCTIGM/WSZ VIMIGI D C9 / ; ZT DCRUZ ; JF; NG HICZ ; tTHWSEZLC9/GF MILINKUMAR HARJIVANBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/ DHCTLD/JJFVUGL
 VZHIVMITYFTGF5Z
 YI ['SH 'JICIGLJUTMNXEJT]ZHL:8Z

s! f; AWT PIO GNCMMYPSRZLb CLERK - I

(Mun.Secretary)

sZf PIO H[HICZ; tTDO/'C9/'K[T]; tTDO/G[G]D o ; ZT'dI]G; 5, 'SMMXG

SD	VZHNEZG) GEDq ZGD)VGI VZHIGL TEZIB	VZHLD?I RGL TEZIB	VZHNEZ AIP5IPV/ K[S] SDm	DRU 'DRCTIGE LJUT's8]DF	HMVZHEVYJFT[GMSM >'EFU'Vgi GPTANL '1 SZFI 'CM 'TM'; AAWT 'HFCZ; tT'D0/GI'1J UT'VGP'TANL, 'SIFGL TEZIBs; 5]6'SP'VXT0' T]:5Q'NXEJJf	D/ '0L s~Rf	SH NYL'GSSES Z EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJGELKk, E TEZIB	VZHNEZDRU 'DHCTL						ZIDES; 's PIO GF IG6T'; D[YI E 5YDqAIHEV5L GE LJUT#56'VCE VR\$'NXEJJf
								HMCRATM			HMDHCTLV5] GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE V5L Kht'CPq GF	VXTo' V5L Kht'CPq GF	J; SZJDR VEJ GS, RHE GL ZSD s~Rf R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWZ[GSEZH ' KhtS, Dv('s! fsS f'YE('s! fs9f4) 4! ! 4S4Vgl	
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
				VE RIRGZ5) GL DRU DHCTLV5JF AFATP			31/01/2024	03/01/2024	GF	CF				v
4	C; DB JIPWMSII F 15/01/2024	15/01/2024	GF	VE RIRGZ5*_GL DRU DHCTLV5JF AFATP	HICZ; tT'D0/GI 03/02/2024		14/02/2024		GF	GF				v
				VE RIRGZ5*_GL DRU DHCTLV5JF AFAT			14/02/2024	06/04/2024	CF	GF				v
5	VIEQ\$ JMF 19/01/2024	19/01/2024	GF	VE RIRGZ&! (GL DRU DHCTLV5JF AFATP			18/02/2024	01/03/2024	CF	GF				v
6	T-CFRNJE F													

ZHL:8Z GDEM!

DHCTIGM/IMSEZ VIWGI D C9/ ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTHWSEZLC9/GF MILINKUMAR HARJIVANBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/ DHCTLD/JJFVUGL
 VZHIVMITYFTGF5Z
 YI ['SH JICIGLJUTMNXEJT]ZHL:8Z

s! f; AIWT PIO GNCMMYPSRZLb CLERK - I

(Mun.Secretary)

sZf PIO H[HICZ; tTDO/'C9/'K[T]; tTDO/G[G]D o ; ZT'dI]G]; 5, 'SMMXG

SD	VZHNEZG) G8Dq; ZGD)VGI VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[S] SDm	DRU['DRCTIGE LJUT's8]SD#	HMVZHE'VYJFT[GMSM >'EFU'VgI G'PTANL '1 SZFI ['CM 'TM'; AIWT 'HFCZ; tT'DO/G'EIJ UT'VGP'TANL 'SIFGL TEZIBs; '5]6'S'VXT0' T]:5Q'NXEJJf	D/['0L s~Rf	SH NYL'GSSES Z[EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJGELKk, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES; 's PIO GF IG6T'; 8]YI [E 5YDqAIHE'V5L GE LJUTR'56'VCE VR\$'NXEJJf
								HMCRATM			HMDHCTLV5[GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE V5L Kht'CPq GF	VXT0' V5L Kht'CPq GF	J;] SZJDR VEJ[GS, RHE GL ZSD s~Rf R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWZ[GSEZH ['1 KhtS, Dv('s! fsS f'YE(s! fs9f4) 4! ! ZS4Vgl	
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
	19/01/2024	19/01/2024	GF	VE RIRGZ&#! GL DRU[DHCTLV5JF AFATP			18/02/2024	17/02/2024	CF	GF	12.00 15/02/2024			12.00 v
7	EE , E AIP JQ6J 17/01/2024	19/01/2024	GF	VE RIRG5## HGZ, AMTIZhM]KG GP! S TYFVgl DNF GP! YL) AFATGL DHCTLD RUTLVZHL			18/02/2024	06/02/2024	CF	GF				v
8	T-CFRNJE F 20/01/2024	20/01/2024	GF	VE RIRGZ&S#GL DRU[DHCTLV5JF AFATP			19/02/2024	16/02/2024	CF	GF				v
9	T-CFRNJE F 20/01/2024	20/01/2024	GF											

ZHL:8Z GDEM!

DHCTIGM/IVSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HFCZ ; tTHWSEZLC9/GF MILINKUMAR HARJIVANBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/] DHCTLD/JJFVUGL
 VZHIVMITYFTGF5Z
 YI ['SH 'JICIGL;LJUTMNXEJT]ZHL:8Z

s! f; AIWT PIO GMCMMYPSRZLb CLERK - I (Mun.Secretary)
 szf PIO H[HICZ'; tTBD0/'C9/'K[IT]; tTBD0/G[GHD] o ; ZT'dI]GL; 5; 'SMXK

SD	VZHNEZG) GBDq; ZGD)VGL VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[IS] SDm	DRU['DRCTIGE LJUT's8]SDf	HMVZHE'VYJFT[GMSM >'EFU'Vgi GPTANL '1 SZEL ['CM 'TM'; AIWT 'HFCZ; tTf'D0/G[1J UT'VGP'TANL 'SI FGL TEZIBs; 5]6'Sf'VXT0' Tf:5Q'NXEJJf	D/['0L s~ff	SH NYL'GSSSES Z[EDNT'DHA' DHCTE'Vf5JFq GSEJRGLEKk, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES' 's PIO GF IG6T'; BfYI [E 5YDqAIHE'V5L GL LJUT#56'VCE VR\$'NXEJJf
								HMCRATM			HMDHCTLVf5[GF			
								DHCTL VfM RGL TEZIB	5Z5ZE Vf5L Kht'CFq GF	VXT0' Vf5L Kht'CFq GF	J; j SZJDR VEJ[GS, RHE[GL ZSD s~ff R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VfWZ[GSEZH ['1 KhtS, Dv('s! fsS f'YE(s! fs9f4) 4! !ZS4Vgl	
s! f	szf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
				VE RIRGZ&SSGL DRU[DHCTLVf5JF AFATP			19/02/2024	16/02/2024	CF	GF	4.00 15/02/2024			4.00 v
10	T-CFRNJE F 25/01/2024	25/01/2024	GF	VE RIRGZ&(ZGL DRU[DHCTLVf5JF AFATP			24/02/2024	06/03/2024	CF	GF	4.00 05/03/2024			4.00 v
11	XB VIOTFAVE, D SP 25/01/2024	25/01/2024	GF	VE RIRGZ&*) GL DRU[DHCTLVf5JF AFATP	: DE5PGI 17/02/2024		24/02/2024		GF	GF				v
				VE RIRGZ&*) GL DRU[DHCTLVf5JF AFATP		24/02/2024	03/04/2024	GF	CF				v	

ZHL:8Z GDEM!

DHCTIGM/IMSEZ VIWGI D C9/ ; ZT DCRUZ ; JF; NG HICZ ; tTHWSEZLC9/GF MILINKUMAR HARJIVANBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/ DHCTLD/JJFVUGL
 VZHIVMITYFTGF5Z
 YI| 'SH'JICIG|LJUTMNXEJT|ZHL:8Z

s! f; AIWT PIO GNCMMYPSRZLb CLERK - I (Mun.Secretary)
 szf PIO H[HICZ; tTDO/'C9/'K[|; tTDO/G[G]D o ; ZT'd|JG|; 5; 'SMMXG

SD	VZHNEZG) G8Dq ZGD)VGI VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV K[S SDm	DRU 'DRCTIGE LJUT's8SDFF	HMVZHE'VYJFT[GMSM >'EFU'Vgi GPTANL '1 SZFI 'CM 'TM'; AIWT 'HFCZ; tT'D0/G'1J UT'VGP'TANL 'SI FGL TEZIBs; '5)6'S'VXT0' T :5Q'NXEJf	D/ '0L s-ff	SH NYL'GSSES Z EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJGELKk, E TEZIB	VZHNEZDRU 'DHCTL						ZIDES' 's PIO GF IG6T'; 8FYI E 5YDqAIHEV5L GE LJUT#56'VCE VR\$'NXEJf
								HMCRATM			HMDHCTLVE5 GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE VF5L Kht'CFq GF	VXT0' VF5L Kht'CFq GF	J; SZJDR VEJ GS, RHE GL ZSD s-ff R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWZ[GSEZH ' KhtS, Dv('s! fsS f'YE(s! fs9f4) 4! ! ZS4Vgl	
s! f	szf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
12	INOK AFAEF AMZF 29/01/2024	31/01/2024	GF	VF RIRG555 DM 5E a, M GP Z_! q! q5S14OH G, 8H5IP:SID GP!_ s5E f OP% M GP !!* JE/LHDIGDR GD CE SMDF p5l:YT YI NEF 5SZ6 :5P; IPVGP !_S5Sg_Z! DR TR_(q_) q_ZZ G VM, VMZGF VG WG OH G, 8H5IP:SID TYF			01/03/2024	01/03/2024	CF	GF				v
13	VISTSDZ ; JG, EE 5EZB 08/02/2024	08/02/2024	GF											

ZHL:8Z GDEM!

DHCTIGM/IWSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HFCZ ; tTHWSEZLC9/GF MILINKUMAR HARJIVANBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/[DHCTLD/JJFVUGL
 VZHIVMITYFTGF5Z
 YI ['SH 'JICIGLJUTMNXEJT]ZHL:8Z

s! f; AIWT PIO GMCMMYPSRZLb CLERK - I (Mun.Secretary)
 szf PIO H[HICZ; tTDO/'C9/'K[T]; tTDO/G[GHD o ; ZT'dI]G; 5; 'SMXKG

SD	VZHNEZG) GHDq ZGD)VGL VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[S] SDm	DRU['DRCTIGE LJUT's8]DF	HMVZHE'VYJFT[GMSM >'EFU'Vgi GPTANL '1 SZFI ['CM 'TM'; AIWT 'HFCZ; tT'D0/GELJ UT'VGP'TANL 'SIFGL TEZIBs; '5]6'SP'VXT0' T! :5Q'NXEJJf	D/['0E' s~RF	SH NYL'GSSES Z[EDNT'DHA' DHCTE'VE5JFq GSEJRGLEKk, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES' 's PIO GF IG6T'; D[YI] E 5YDqAIHEV5L GE LJUTR'56'VCE VR\$'NXEJJf
								HMCRATM			HMDHCTLVE5[GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE VE5L Kht'CFq GF	VXT0' VE5L Kht'CFq GF	J;] SZJDR VEJ[GS, RHE GL ZSD s~RF R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWZ[GSEZH [' KhtS, Dv('s! fsS f'YE'(s! fs9f4) 4! ! ZS4Vgl	
s! f	szf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
				VE RIRG5&# ; D5HDSM OE , U5 YI[CM TMGL I; SIMBLKMFDRB[V[OLGf! __@ZSD VGjI H GF5_@ SZD VE5JFDH GF :YF; P9RGP! q_Z# TPZZq+5qZ# YI[KPT[TYFVgl AFATGLDHCTL DRUTLVZHL			09/03/2024	28/02/2024	CF	GF	2.00 27/02/2024			2.00 v
14	DM SAE XB 09/02/2024	09/02/2024	GF	VE RIRGZ((5GL DRU[DHCTLVE5JF AFATP			10/03/2024		GF	GF				20243000120 12/04/2024 v
15	l5S, 5P] Ra 3LJE/F 20/02/2024	20/02/2024	GF											

ZHL:8Z GDEM!

DHCTIGM/IMSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HFCZ ; tTHWSEZLC9/GF MILINDKUMAR HARJIVANBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/ DHCTLD/JJFVUGL
 VZHIVMITYFTGF5Z
 YI | 'SH'JICIGL;LJUTMNXEJT|ZHL:8Z

s! f; AIWT PIO GNCMMYPSRZLb CLERK - I (Mun.Secretary)
 szf PIO H[HICZ; tTDO/'C9/'K[T]; tTDO/G[G]D o ; ZT'dI]G; 5, 'SMMXG

SD	VZHNEZG) GBDq; ZGD)VGI VZHIGL TEZIB	VZHLD?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[S] SDm	DRU 'DRCTIGE LJUT's8]SDf	HMVZHE'VYJFT[GMSM >'EFU'Vgi G[TANL '1 SZFI 'CM 'TM'; AIWT 'HFCZ; tT'D0/G'1J UT'VGP'TANL, 'SI FGL TEZIBs; 5]6'S[VXT0' T]:5Q'NXEJJf	D/ '0L s~ff	SH NYL'GSSES Z EDNT'DHA' DHCTE'VE5JFq GSEJRGLEKk, E TEZIB	VZHNEZDRU 'DHCTL						ZIDES; 's PIO GF IG6T'; D[YI] E 5YDqAIHEV5L GL LJUT#56'VCE VR\$'NXEJJf
								HMCRATM			HMDHCTLV5] GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE V5L Kht'CPq GF	VXTo' V5L Kht'CPq GF	J; SZJDR VEU] GS, RHE] GL ZSD s~ff R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWWEZ[GSEZH ' KhtS, Dv('s! fsS f'YE('s! fs9f4) 4! !ZS4Vgl	
s! f	szf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
				VE RIRGP#_*GL DRU DHCTLV5JF AFATP			21/03/2024	03/04/2024	CF	GF				v
16	DMHEJN BIG 26/02/2024	26/02/2024	GF	VE RIRGP#_*ZGL DRU DHCTLV5JF AFATP			27/03/2024	04/03/2024	CF	GF				v
17	VHI VEPDE 5GL 28/02/2024	28/02/2024	GF	VE RIRGP#!_ZGL DRU DHCTLV5JF AFATP	: D5PGL 18/03/2024		29/03/2024		GF	GF				v
				VE RIRGP#!_ZGL DRU DHCTLV5JF AFATP			29/03/2024	18/03/2024	GF	CF				
18	VNMFLJ V] P													

ZHL:8Z GDEM!

DHCTIGM/WSZ VIMIGI D C9 / ; ZT DCRUZ ; JF; NG HICZ ; tTHWSEZLC9/GF MILINKUMAR HARJIVANBHAI PATEL (P.I.O./A.P.I.O.) G[D/ DHCTLD/JJFVUGL
 VZHIVMITYFTGF5Z
 YI ['SH 'JICIGI;LJUTMNXEJT]ZHL:8Z

s! f; AWT PIO GMCMMYPSRZLb CLERK - I (Mun.Secretary)
 szf PIO H[HICZ; tTDO/'C9/'K[T]; tTDO/G[G]D o ; ZT'dI]GI; 5, 'SMMXG

SD	VZHNEZG) GEDq; ZGD)VGI VZHIGL TEZIB	VZHL D?I RGL TEZIB	VZHNEZ AIP5IPV[K[SI SDm	DRU['DRCTIGE LJUT's8SDFF	HMVZHE'VYJFT[GMSM >'EFU'VGI GPTANL '1 SZFI ['CM 'TM'; AAWT 'HFCZ; tT'DO/GI'J UT'VGP'TANL 'SI FGL TEZIBs; 5)6'S'VXT0' T':5Q'NXEJf	D/['0L s~FF	SH NFYLGSES Z[EDNT'DHA' DHCTE'VE5JFq GSEZJGKk, E TEZIB	VZHNEZDRU['DHCTL						ZIDES; 's PIO GF IG6T'; D[YI] E 5YDqAIHEV5L GE LJUT#56'VCE VR\$'NXEJf
								HMCRATM			HMDHCTLV5[GF			
								DHCTL VPA RGL TEZIB	5Z5ZE V5L Kht'CPq GF	VXT0' V5L Kht'CPq GF	J; j SZJDR VEJ[GS, RHE GL ZSD s~FF R/D/P. No	DHCTL GSH RGL TEZIB	SH NGES. 'S, DGF 'VWZ[GSEZH ['1 KhtS, Dv('s! fsS f'YE(s! fs9f4) 4! ! ZS4Vgl	
s! f	szf	s#f	sSf	s5f	s&f	s*f	s(f	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf	s! 5f
	02/03/2024	02/03/2024	GF	VE RIRG#! S*GL DRU[DHCTLV5JF AFATP			01/04/2024	01/04/2024	CF	GF	2.00 28/03/2024			2.00 v
19	5\$KKEE LJGMEE S#58Z													
	11/03/2024	11/03/2024	GF	VE RIRG#! *! GL DRU[DHCTLV5JF AFATP			10/04/2024	21/03/2024	CF	GF	6.00 20/03/2024			6.00 v
20	D\$KKEE AIP58{													
	28/03/2024	28/03/2024	GF	VE RIRG# #SZGL DRU[DHCTLV5JF AFATP			27/04/2024	18/04/2024	CF	GF				VZHNEZG]; \$BZL VMD; 5ZTLDHCTL H~ZLGYIP

ZHL:8Z GDGMZ

DHCTIGM/VWSEZ VIMGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTDD0/15ZGFV5[B1VMMI8IG|DHCTLD|/JJFVUGLVZHIVMIFYFTGP5Z'YI| 'SE'JFCIGL|JUTMNXEJT|ZHL:8Z

s! f; AIWT'A.A. GMCMMYPSRZLb

SHARADCHANDRA RAMANLAL PATEL

Designation: DEPUTY SECRETARY

BCNT: Municipal Secretary's Office

sZf A.A. H|HICZ'; tTDD0/'C9/'K|T|; tTDD0/G|GD o

; ZTDCRGUZ;5E ISF

SD	V5L SZGZG) GD q; ZGD) VG TEZIB	V5L D?I RGL TEZIB	V5L STP BPL K S SDmCFq GF	H PIO GFCSD ; ED V5L YI K T PIO G GD4 CMMV/G TGF CSD GAZ VG TEZIB	SE NGL GSSL SZ DNT DHA V5L, GM IGSE SZJRL K , L TEZIB	V5L V WSEZLV SZ ; GEJ6IGL TEZIB	VZHNEZ V5L VgJI DRU DHCTLVU A.A. GMG6I					V5L 1 V WSEZIGF IG6I GE; ED ZHI 1 DHCTI VH NDR; Sg01V5L 1 YI 'K S SDmHMCPCM' TM 'TGE ; YU'AT'JUT	VH N GMG6I s; Y P'EDF sVH N GMG6I V5L STFGL LJ-wDRCM TM S. S. DMGFVWZ IG6I , IW KP
		. GJ0 GAZ					V5L 5Z5ZLS VXT0 DHZ SZJDRVEJLCM TM			HMV5L GDHZ SZJDRVEJLCM TM			
							CSDGL TEZIB	V5L 5Z5ZL DHZ SZJDR VEJLK CFq GF	V5L VXT0 DHZ SZJDR VEJL K CR GF	CSDGL TEZIB	SE NGL S. S, DGF VWZ GDHZ SZ K		
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f)	s) f	s! _f	s! ! f	s! Zf	s! #f	s! \$f
1 20233000109	T<CFRNLJE F 27/04/2023	28/04/2023 CCC/CZ/10 3	GF	SATISHKUM AR LALBHAI PATEL RTI/SEC/OUT /16 17/02/2023	28/05/2023		22/05/2023	CF	GF			OZIN GP V5L, GP	

ZHL:8Z GDGMZ

DHCTIGM/VWSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTDO/15ZGFV5[B1VMMI8IG|DHCTLD|/JJFVUGLVZHIVMIFYFTGP5Z'YI| 'SE'JICIG|LJUTMXXEJT|ZHL:8Z

s! f; AIWT'A.A. GMCMMYPSRZLb

SHARADCHANDRA RAMANLAL PATEL

Designation: DEPUTY SECRETARY

BCNT: Municipal Secretary's Office

sZf A.A. H|HICZ'; tTDO/'C9/'K|T|; tTDO/G|GD o

; ZTDCRGUZ;5E ISF

SD	V5L SZGZG) GD q; ZGD) VG TEZIB	V5L D?I RGL TEZIB	V5L STP BPL K S SDmCFq GF	H PIO GFCSD ; ED V5L YI K T PIO G GD4 CMMV G TGF CSD GAZ VG TEZIB	SE NGL GSSL SZ DNT DHA V5L, GM IGSE SZJRL K , L TEZIB	V5L VIWSEZIV SZ ; GEJ6IGL TEZIB	VZHNEZ V5L VgJI DRU DHCTLVU A.A. GMG6I					V5L 1 VIWSEZIGF IG6I G ; ED ZHI 1 DHCTI VEH NDR; Sg01V5L 1 YI 'K S SDmHMCFCM 1TM 'TGE ; YU9T1JUT	VEH NMG6I s; YI9TDF sVH NMG6I V5L STFGL LJ-wDRCM TM S. S. DMGFVWEZ IG6I , IW KP
		. GJ0 GAZ					V5L 5Z5ZLS VXT0 DHZ SZJDRVEJLCM TM			HMV5L GDHZ SZJDRVEJLCM TM			
							CSDGL TEZIB	V5L 5Z5ZL DHZ SZJDR VEJLK CFq GF	V5L VXT0 DHZ SZJDR VEJL K CR GF	CSDGL TEZIB	SE NGL S. S. DGF VWEZ GDHZ SZ K		
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f)	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf
2 20233000110	T<CFRNLJE F 28/04/2023	28/04/2023 CCC/CZ/10 4	GF	SATISHKUM AR LALBHAI PATEL RTI/SEC/OUT /17 17/02/2023	28/05/2023		22/05/2023	CF	GF			OZIN GP V5L GP	

ZHL:8Z GDGMZ

DHCTIGM/VWSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTDD0/15ZGFV5[B1VMMI8IG|DHCTLD|/JJFVUGLVZHIVMIFYFTGP5Z'YI| 'SE'JCIGL|JUTMNXEJT|ZHL:8Z

s! f; AIWT'A.A. GMCMMYPSRZLb

SHARADCHANDRA RAMANLAL PATEL

Designation: DEPUTY SECRETARY

BCNT: Municipal Secretary's Office

sZf A.A. H|HICZ'; tTDD0/'C9/'K|T|; tTDD0/G|GD 0

; ZTDCRGUZ;5E ISF

SD	V5L SZGZG) GD q; ZGD) VG TEZIB	V5L D?I RGL TEZIB	V5L STF BPL K S SDmCFq GF	H PIO GFCSD ; ED V5L YI K T PIO G GD4 CMMV G TGF CSD GAZ VG TEZIB	SE NGL GSSL SZ DNT DHA V5L, GM IGSE SZJRL K , L TEZIB	V5L VIWSEZLV SZ ; GEJ6IGL TEZIB	VZHNEZ V5L VgJI DRU DHCTLVU A.A. GMG6I					V5L 1 VIWSEZIGF IG6I G ; ED ZHI 1 DHCTI VEH NDR; Sg0'V5L 1 YI 'K S SDmHMCPCM' TM 'TGE ; YU'AT'LJUT	VEH NMG6I s; YI'P'DR sVH NMG6I V5L STFGL LJ-wDRCM TM S. S. DMGFVWZ IG6I , IW KP
		. GJ0 GAZ					V5L 5Z5ZLS VXT0 DHZ SZJDRVEJLCM TM			HMV5L GDHZ SZJDRVEJLCM TM			
							CSDGL TEZIB	V5L 5Z5ZL DHZ SZJDR VEJLK CFqGF	V5L VXT0 DHZ SZJDR VEJL K CRGF	CSDGL TEZIB	SE NGL S. S, DGF VWZ GDHZ SZ K		
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f)	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! \$f
3 20233000253	HXJTI; C VPAHCEI 22/05/2023	22/05/2023 CCC/CZ/17 5	GF	SATISHKUM AR LALBHAI PATEL RTI/SEC/OUT /36 09/05/2023	21/06/2023	02/06/2023	03/06/2023	CF	GF			OZIN GP V5L, GP	

ZHL:8Z GDGMZ

DHCTIGM/VWSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTDD0/15ZGFV5[B1VMMI8IG|DHCTLD|/JJFVUGLVZHIVMFTTGP5Z'YI| 'SE'JRCIGL|JUTMXXEJT|ZHL:8Z

s! f; AIWT'A.A. GNCMMYPSRZLb

SHARADCHANDRA RAMANLAL PATEL

Designation: DEPUTY SECRETARY

BCNT: Municipal Secretary's Office

sZf A.A. H|HICZ'; tTDD0/'C9/'K|T|; tTDD0/G|GD o

; ZTDCRGUZ;5E ISF

SD	V5L SZGZG) GD q; ZGD) VG TEZIB	V5L D?I RGL TEZIB	V5L STF BPL K S SDmCFq GF	H PIO GFCSD ; ED V5L YI K T PIO G GD4 CMMV G TGF CSD GAZ VG TEZIB	SE NGL GSSL SZ DNT DHA V5L, GM IGSE SZJGL K , L TEZIB	V5L VIWSEZIV SZ ; GEJ6IGL TEZIB	VZHNEZ V5L VgJI DRU DHCTLVU A.A. GMG6I					V5L '1 VIWSEZIGF IG6I GE; ED ZHI '1 DHCTI VEH NDR; Sg0'V5L '1 YI 'K S SDmHMCPCM 'TM 'TGE ; YU'AT'LJUT	VEH NMG6I s; YI'P'DR sVH NMG6I V5L STFGL LJ-wDRCM TM S. S. DMGFVWEZ IG6I , IW KP
		. GJ0 GAZ					V5L 5Z5ZLS VXT0 DHZ SZJDRVEJLCM TM			HMV5L GDHZ SZJDRVEJLCM TM			
							CSDGL TEZIB	V5L 5Z5ZL DHZ SZJDR VEJLK CFq GF	V5L VXT0 DHZ SZJDR VEJL K CR GF	CSDGL TEZIB	SE NGL S. S, DGF VWEZ GDHZ SZ K		
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f)	s) f	s! _f	s! ! f	s! Zf	s! #f	s! \$f
4	ZDK SPHRUO	27/06/2023	GF	SATISHKUM AR LALBHAI PATEL RTI/SEC/OUT /51 15/06/2023	27/07/2023	24/07/2023	24/07/2023	CF	GF			OZIN GP V5L, GP	
20233000356	27/06/2023	CCC/CZ/22 7					13 V5L VZHL NOTZ VE> 0L GR5Z VU DHCTL VEJFAFAT						

ZHL:8Z GDGMZ

DHCTIGM/VWSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTDD0/15ZGFV5[B1VMMI8IG|DHCTLD|/JJFVUGLVZHIVMIFYFTGP5Z'YI| 'SE'JRCIGL|JUTMNXEJT|ZHL:8Z

s! f; AIWT'A.A. GMCMMYPSRZLb

NITINCHANDRA PANDHARINATH SONJ

Designation: DEPUTY SECRETARY

BCNT: Municipal Secretary's Office

sZf A.A. H|HCZ'; tTDD0/'C9/'K|T|; tTDD0/G|GD o

; ZTDCRGUZ;5E ISF

SD	V5L SZGZG) GD q; ZGD) VG TEZIB	V5L D?I RGL TEZIB	V5L STP BPL K S SDmCFq GF	H PIO GFCSD ; ED V5L YI K T PIO G GD4 CMMV/G TGF CSD GAZ VG TEZIB	SE NGL GSSL SZ DNT DHA V5L, GM IGSE SZJRL K , L TEZIB	V5L VIWSEZLV SZ ; GEJ6IGL TEZIB	VZHNEZ V5L VgJI DRU DHCTLVU A.A. GMG6I					V5L 1 VIWSEZIGF IG6I GE; ED ZHI 1 DHCTI VEH NDR; Sg0'V5L 1 YI 'K S SDmHMCPCM' TM 'TGE ; U'9T'JUT	VEH NMG6I s; V P'EDF sVH NMG6I V5L STFGL LJ~wDRCM TM S. S. DMGFVWEZ IG6I , IW KP
		. GJ0 GAZ					V5L 5Z5ZLS VXT0 DHZ SZJDRVEJLCM TM			HMV5L GDHZ SZJDRVEJLCM TM			
							CSDGL TEZIB	V5L 5Z5ZL DHZ SZJDR VEJLK CFqGF	V5L VXT0 DHZ SZJDR VEJL K CRGF	CSDGL TEZIB	SE NGL S. S, DGF VWEZ GDHZ SZ K		
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f)	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! \$f
1 20233000606	D5KEE AIP58 12/10/2023	12/10/2023 CCC/CZ/42 9	GF	SATISHKUM AR LALBHAI PATEL RTI/SEC/OUT /45 05/06/2023	11/11/2023	30/10/2023	08/11/2023	CF	GF			OZIN GP V5L GP	

ZHL:8Z GDGMZ

DHCTIGM/VWSEZ VIMGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTDD0/15ZGPFV5[B1VMMI8IG|DHCTLD|/JJFVUGLVZHIVMIFYFTGP5Z'YI| 'SE'JRCIGL|JUTM|XET|ZHL:8Z

s! f; AIWT'A.A. GMCMMYPSRZLb

NITINCHANDRA PANDHARINATH SONJ

Designation: DEPUTY SECRETARY

BCNT: Municipal Secretary's Office

sZf A.A. H|HICZ'; tTDD0/'C9/'K|T|; tTDD0/G|GD o

; ZTDCRGUZ;5E ISF

SD	V5L SZGZG) GD q; ZGD) VG TEZIB	V5L D?I RGL TEZIB	V5L STP BPL K S SDmCFq GF	H PIO GFCSD ; ED V5L YI K T PIO G GD4 CMMV/G TGF CSD GAZ VG TEZIB	SE NGL GSSL SZ DNT DHA V5L GM IGSE SZJRL K , L TEZIB	V5L V WSEZ V SZ ; GEJ6IGL TEZIB	VZHNEZ V5L VgJI DRU DHCTLVU A.A. GMG6I					V5L 1 V WSEZ GF IG6I GE; ED ZHI 1 DHCT VH NUDR; Sg0'V5L 1 YI 'K S SDm HMCPCM' TM 'TGE ; U'9T'1JUT	VH N GMG6I s; 1 P'EDF sVH N GMG6I V5L STFGL LJ~wDRCM TM S. S. DMGFVWZ IG6I , DW KP
		. GJ0 GAZ					V5L 5Z5ZLS VXT0 DHZ SZJDR VEJLCM TM			HMV5L GDHZ SZJDR VEJLCM TM			
							CSDGL TEZIB	V5L 5Z5ZL DHZ SZJDR VEJLK CFq GF	V5L VXT0 DHZ SZJDR VEJL K C H GF	CSDGL TEZIB	SE NGL S. S. DGF VWZ GDHZ SZ K		
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f)	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! \$f
2 20233000611	T<CFR NJF F 18/10/2023	19/10/2023 GAD/EST/I N/6774	GF	SATISHKUM AR LALBHAI PATEL RTI/SEC/OUT /89 06/10/2023	18/11/2023	08/11/2023	08/11/2023	CF	GF			OZIN GP V5L GP	

ZHL:8Z GDGMZ

DHCTIGM/VWSEZ VIMGI D CØ / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTØ0/¹5ZGFV5[B¹VMIM8IG|DHCTLD|JJFVUGLVZHIVMIFYFTGP5Z¹YI| 'SE¹JCIGL|JUTM¹XEJT|ZHL:8Z

s! f; AIWT¹A.A. GMCMMTYPSRZLø

NITINCHANDRA PANDHARINATH SONJ

Designation: DEPUTY SECRETARY

BCNT: Municipal Secretary's Office

sZf A.A. H¹HCZ¹; tTØ0/¹CØ/¹K¹T¹; tTØ0/G¹GD ø

; Z¹YDCRGUZ¹5E ISF

SD	V5L SZGZG) GØD q; ZGHØ) VG¹TEZIB	V5L D¹I RGL TEZIB	V5L STF BPL K¹S¹ S¹DmCFq GF	H¹PIO GFCSD ; ØD¹V5L YI¹ K¹T¹PIO G¹GHØ4 CMMV/G¹TGF CSD GAZ VG¹ TEZIB	S¹NRGL GSSL SZ¹ DNT DHA V5L GM IGSE SZJRL K¹, L TEZIB	V5L VIMSEZLV¹ SZ¹ ; GEJ6IGL TEZIB	VZHNEZ¹V5L VgJ¹¹DRU¹ DHCTLVU¹A.A. GMG6¹					V5L ¹ VIMSEZIGF IG6¹IG¹; ØD¹ZHI¹ DHCTLV¹H NDR¹; Sg¹V5L ¹ YI¹ 'K¹S¹S¹Dm¹HMCFCM¹¹TM¹TGE¹; Y¹¹¹¹JUT	VH¹MGMG6¹ s; Y¹¹¹¹DR¹ sVH¹MGMG6¹ V5L STFGL LJ~wDRCM TM S. S. DMGFVWZ¹ IG6¹, DM¹ KP
		. GJØ¹ GAZ					V5L 5Z¹ZLS¹VXTø DHZ SZJDR¹VEJLCM TM			HMV5L GØDHZ SZJDR¹VEJLCM TM			
							CSDGL TEZIB	V5L 5Z¹ZL DHZ SZJDR¹ VEJLK¹m CFqGF	V5L VXTø DHZ SZJDR¹ VEJL K¹m C¹mGF	CSDGL TEZIB	S¹NRGL S. S. DGF V¹WZ¹ GØDHZ SZ¹ K¹m		
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f)	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! Sf
3 20233000624	T<CFR¹NLJF F 02/11/2023	08/12/2023 ACT/IN/4606	GF	SATISHKUM AR LALBHAI PATEL RTI/SEC/OUT /91 19/10/2023	07/01/2024	05/01/2024	20/01/2024	CF	GF			OZ¹IN GP V5L GP	

ZHL:8Z GDGMZ

DHCTIGM/VWSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTDD0/15ZGFV5[B1VMMI8IG|DHCTLD|/JJFVUGLVZHIVMIFYFTGP5Z'YI| 'SE'JRCIGL|JUTMXXEJT|ZHL:8Z

s! f; AIWT'A.A. GMCMMYPSRZLb

NITINCHANDRA PANDHARINATH SONJ

Designation: DEPUTY SECRETARY

BCNT: Municipal Secretary's Office

sZf A.A. H|HCZ'; tTDD0/'C9/'K|T|; tTDD0/G|GD o

; ZTDCRGUZ;5E ISF

SD	V5L SZGZG) GD q; ZGD) VG TEZIB	V5L D?I RGL TEZIB	V5L STP BPL K S SDmCFq GF	H PIO GFCSD ; ED V5L YI K T PIO G GD4 CMMV/G TGF CSD GAZ VG TEZIB	SE NGL GSSL SZ DNT DHA V5L, GM IGSE SZJRL K , L TEZIB	V5L VIWSEZIV SZ ; GEJ6IGL TEZIB	VZHNEZ V5L VgJI DRU DHCTLVU A.A. GMG6I					V5L 1 VIWSEZIGF IG6I GE; ED ZHI 1 DHCTI VEH NDR; Sg01V5L 1 YI 'K S SDmHMCPCM' TM 'TGE ; YU'WT1JUT	VEH NMG6I s; YI'P'DRF sVH NMG6I V5L STFGL IJ-wDRCM TM S. S. DMGFVWWEZ IG6I , IW KP
		. GJ0 GAZ					V5L 5Z5ZLS VXT0 DHZ SZJDRVEJLCM TM			HMV5L GDHZ SZJDRVEJLCM TM			
							CSDGL TEZIB	V5L 5Z5ZL DHZ SZJDR VEJLK CFqGF	V5L VXT0 DHZ SZJDR VEJL K CRGF	CSDGL TEZIB	SE NGL S. S. DGF VWWEZ GDHZ SZ K		
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f)	s) f	s!_f	s! ! f	s! Zf	s! #f	s! \$f
1 20233000881	C; DB JIPWMSII F 15/02/2024	15/02/2024 CCC/CZ/66 2 TO 665	GF	MILINDKUM AR HARJIVANB HAI PATEL RTI/SEC/OUT /54 06/04/2024	16/03/2024	19/03/2024	22/03/2024	CF	GF			OZIN GP V5L, GP	

ZHL:8Z GDGMZ

DHCTIGM/VWSEZ VIWGI D C9 / ; ZT DCRGUZ ; JF; NG HICZ ; tTDD0/15ZGFV5[B1VMMI8IG|DHCTLD|JFVUGLVZHIVMFTTGP5Z'YI| 'SE'JCIGL|JUTMXXEJT|ZHL:8Z

s! f; AIWT'A.A. GMCMMYPSRZLo

NITINCHANDRA PANDHARINATH SONJ

Designation: DEPUTY SECRETARY

BCNT: Municipal Secretary's Office

sZf A.A. H|HCZ'; tTDD0/'C9/'K|T|; tTDD0/G|GD o

; ZTDCRGUZ;5E ISF

SD	V5L SZGZG) GD q; ZGD) VG TEZIB	V5L D?I RGL TEZIB	V5L STP BPL K S SDmCFq GF	H PIO GFCSD ; ED V5L YI K T PIO G GD4 CMMV/G TGF CSD GAZ VG TEZIB	SH NGL GSSL SZ DNT DHA V5L GM IGSE SZJRL K , L TEZIB	V5L VIWSEZIV SZ ; GEJ6IGL TEZIB	VZHNEZ V5L VgJI DRU DHCTLVU A.A. GMG6I					V5L 1 VIWSEZIGF IG6I GE; ED ZHI 1 DHCTI VH NDR; Sg0'V5L 1 YI 'K S SDmHMCPCM TM 'TGE ; YU'AT'JUT	VH N GMG6I s; YI'P'DF sVH N GMG6I V5L STFGL IJ~wDRCM TM S. S. DMGFVWZ IG6I , IW KP
		. GJ0 GAZ					V5L 5Z5ZLS VXT0 DHZ SZJDRVEJLCM TM			HMV5L GDHZ SZJDRVEJLCM TM			
							CSDGL TEZIB	V5L 5Z5ZL DHZ SZJDR VEJLK CFq GF	V5L VXT0 DHZ SZJDR VEJL K CR GF	CSDGL TEZIB	SH NGL S. S. DGF VWZ GDHZ SZ K		
s! f	sZf	s#f	sSf	s5f	s&f	s*f	s(f)	s) f	s! _f	s! ! f	s! Zf	s! #f	s! \$f
2 20233000911	IRZRU UU, RBL 28/02/2024	29/02/2024 ele&cen/IN/ 15	GF	MILINDKUM AR HARJIVANB HAI PATEL RTI/SEC/OUT /103 09/11/2023	30/03/2024		09/04/2024	GF	GF	09/04/2024		OZIN GP V5L GP	
	IRZRU UU, RBL 28/02/2024	29/02/2024 ele&cen/IN/ 15	GF	MILINDKUM AR HARJIVANB HAI PATEL RTI/SEC/OUT /103 09/11/2023	30/03/2024	22/03/2024	30/03/2024	GF	CF			OZIN GP V5L GP	